

માર્કની લખેલી સુવાર્તા

ઈસુનું આગમન

૧ દેવના દીકરા, ઈસુ અનુષ્ઠાન વિષેની સુવાર્તાનો આરંભ. યથાયા પ્રબોધક જે કંધું છે તે થશે. યથાયાએ લખ્યું છે:

“ધ્યાનથી સાંભળો! હું (દેવ) મારો દૂતને તારી આગળ મોકલીશ. તે તારો માટે માર્ગ તૈયાર કરશે.”
માલાખી ૩:૧

૩ “ત્યાં એક વ્યક્તિ છે જે રેતીના રણમાં પોકાર કરે છે: ‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો. તેના રસ્તા સીધા કરો.’”
યથાયા ૪૦:૩

જેથી યોહાન બાપ્તિસ્ત આવ્યો અને રણપદેશમાં લોકોને બાપ્તિસ્તમા આપ્તો હતો. તેણે લોકોને કંધું કે જો તેઓ તેમના જીવનમાં પરિવર્તન ઈચ્છા હોય તો તે બનાવવા માટે બાપ્તિસ્તમા* પાપો પછી તેમના પાપો માફ કરવામાં આવશે. પયહૂદિયા દેશના અને યરશાલેમના બધા લોકો યોહાન પાસે આવવા નીકળ્યા. આ લોકોએ કરેલાં પાપોની કબૂલાત કર્યા પછી યદેન નદીમાં તેઓ યોહાન દ્વારા બાપ્તિસ્તમા પામ્યા. જીટના વાળમાંથી બનાવેલા વસો યોહાન પહેરતો હતો. યોહાન તેની કમરે એક ચામડાનો પઢો બાંધતો હતો. તે તીડો તથા જગલી મધ્ય ખાતો હતો. યોહાન લોકોને જે ઉપદેશ આપતો હતો તે આ છે: “મારા કરતાં જે વધારે મહાન છે તે મારી પાછળ આવે છે. હું તો તેના ઘૂંઠણો પડવા તથા તેના જોડાની દોરી છાડવા માટે પણ યોગ્ય નથી. એં તમારું પાણીથી બાપ્તિસ્તમા કર્યું. પણ જે વ્યક્તિ આવે છે તે તમારું પવિત્ર આત્માથી બાપ્તિસ્તમા કરશે.”

બાપ્તિસ્તમા આ ગ્રેક ભાષાનો શબ્દ છે જેનો અર્થ પાણીમાં દૂખાડવું થાય છે. આ એક ધાર્મિક કિયા છે.

ઈસુનું બાપ્તિસ્તમા

જે વખતે ઈસુ ગાલીલના નાસરેથથી જ્યા યોહાન હતો તે જગ્યાએ આવ્યો. યોહાને યર્દનની નદીમાં ઈસુને બાપ્તિસ્તમા આપ્યુ. ૧૦ જારે ઈસુ પાણીમાંથી બહાર આવતો હતો ત્યારે તેણે આકાશ ઊંઘાંદું જોયું. પવિત્ર આત્મા ઈસુ પર કબૂતરની જેમ આવ્યો. “આકાશમાંથી એક અવાજ આવ્યો અને કંધું; “તું મારો પુત્ર છે અને હું તને ચાહું છું. હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું.”

ઈસુનું પરીક્ષણ

૧૨ ઘીથી આત્માએ ઈસુને રણમાં મોકલ્યો. ૧૩ ઈસુ રણમાં ૪૦ દિવસો રહ્યો હતો. તે ત્યાં જગલી પશુઓ સાથે હતો. જ્યારે ઈસુ રણમાં હતો ત્યારે શોતાનથી તેનું પરીક્ષણ થયું હતું. અને દૂતાએ આવીને ઈસુની સેવા કરી.

ઈસુ કેટલાક શિષ્યોની પસંદગી કરે છે

૧૪ આ પછી, યોહાનને બંદીખાનામાં મુકવામાં આવ્યો હતો. ઈસુ ગાલીલમાં ગયો અને દેવ તરફથી સુવાર્તા પ્રગટ કરી. ૧૫ ઈસુએ કંધું, “હવે નિશ્ચિત સમય આવી પહુંચયો છે. દેવનું રાજ્ય નજીક છે. પસ્તાવો કરો અને દેવની સુવાર્તામાં વિશ્વાસ કરો!”

૧૬ ઈસુ ગાલીલના સરોવરની બાજુમાં ચાલતો હતો ત્યારે ઈસુએ સિમોન* અને સિમોનના ભાઈ આન્દ્રિયાને જોયો. આ બંને માણસો માછીમારો હતા, અને તેઓ માછલા પકડવા સરોવરમાં જાળ નાખતા હતાં. ૧૭ ઈસુએ તેમને કંધું, “મારી પાછળ આવો, ને હું તમને એક જુદા પકડાના માછીમારો બનાવીશ. તમે લોકોને બેગા કરવાનું કામ કરશો, માછલીઓ નહિએ.” જેથી સિમોન અને આન્દ્રિયાએ તેઓની જાળો છોડી દીધી અને ઈસુની પાછળ ગયા.

૧૮ ઈસુએ ગાલીલ સરોવરની બાજુમાં ચાલવાનું ચાલુ રાખ્યું. તેણે ત્યાં બે વધારે ભાઈઓ, જબદીનો દીકરો

સિમોન સિમોનનું બીજું નામ પિતર હતું.

યાડૂબ અને યોહાનને જોયા. તેઓ હોડીમાં તેમની માઇલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા. ૩૦નેમનો પિતા જબઈ અને તે માજસો કે તેમના માટે ક્રમ કરતા હતા, તેઓ તે ભાઈઓ સાથે હોડીમાં હતા. જ્યારે ઈસુને તે ભાઈઓને જોયા, તેણે તેઓને આવવા કર્યું. તેઓએ તેમના પિતાને છોડ્યા અને ઈસુની પાછળ ગયા.

ઈસુનું અશુદ્ધ આત્માવાળા માણસને સાજા કરવું
૩૧ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમમાં ગયા. વિશ્વામવારે ઈસુ સભાસ્થાનમાં ગયો અને લોકોને ઉપદેશ આપ્યો. ૩૨ત્યાં જે લોકો હતા તેઓ ઈસુના ઉપદેશથી નવાઈ પામ્યા. ઈસુને તેમના શાસીઓની જેમ શીખવ્યુનહિ. પરંતુ ઈસુને જે વ્યક્તિન પાસે અધિકાર હોય તેવી રીતે શીખવ્યુનું. ૩૩જ્યારે ઈસુ સભાસ્થાનમાં હતો, ત્યારે એક અશુદ્ધ આત્મા વળગેલા માણસે બૂમ પાડી, ૩૪"નાગરેથના ઈસુ! તારે અમારી સાથે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું તું કોણ છું-દેવનો એક પાવત્ર!"

૩૫ઈસુએ તેને ઘમકાવતાં કર્યું, "શાંત રહે! તે માણસમાંથી બહાર નીકળા!" ૩૬તે અશુદ્ધ આત્માએ તે માણસને ધૂઢ્યાવી નાખ્યો. પછી તે આત્માએ મોટી બૂમ પાડી અને તે માણસમાંથી બહાર નીકળી ગયો.

૩૭લોકો નવાઈ પામ્યા હતા. તેઓએ એકબીજાને પૂછ્યું: "અહીં શું થઈ રહ્યું છે? આ માણસ કંઈક નવું શીખવે છે. અને તે અધિકારથી શીખવે છે. તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે." ૩૮તેથી ઈસુના સમાચાર જરૂરથી ગાલીવના પ્રદેશમાં સર્વત્ર પ્રસરી ગયો.

ઈસુ ઘણા લોકોને સાજા કરે છે

૩૯ઈસુ અને તેના શિષ્યોએ સભાસ્થાન છોડ્યું. તેઓ યાડૂબ અને યોહાન સાથે ચિમોન અને આનિન્યાના ઘરમાં ગયા. ૪૦ચિમોનની સાસુ બિમાર હતી. તે પથારીમાં હતી અને તેને તાવ હતો. ત્યાંના લોકોએ ઈસુને તેના વિષે કહ્યું, અને ઈસુ તેની પથારી પાસે ગયો. ઈસુએ તેનો હાથ પકડ્યો અને તેને ઉભા થવામાં મદદ કરી. તેને તાવ ઉનરી ગયો અને તે સાજુ થઈ ગઈ. પછીથી તેણે તેઓની સેવા કરવી શરૂ કરી.

૪૧તે રાતે સુર્યાસત થયા પછી લોકો ઘણા માંદા લોકોને ઈસુ પાસે લાવ્યા તથા જેઓને ભૂતો વળગેલા હતા તેવા લોકોને પણ લાવ્યા હતા. ૪૨શહેરના બધા જ લોકો તે ઘરનાં બારણા આગળ ભેગા થયા. ૪૩ઈસુએ

ઘણા લોકો કે જુદા જુદા રોગથી પીડાતા હતા તે બધાને સાજા કર્યા. ઈસુએ ઘણાં ભૂતોને ક્રાદ્યાં. પણ ઈસુએ ભૂતોને બોલવા દીધાં નહિ, ક્રારણ કે ભૂતો જાણતા હતા કે તે ક્રાણ હતો.

ઈસુની સુવાર્તા આપવાની તૈયારી

૩૫બીજુ સવારે, ઈસુ ઘણાં વહેલો ઉઠ્યો. જબારે અંધારું હતું ત્યારે ઈસુએ ઘર છોડ્યું. તે એકાંત જગ્યાએ એકલો પ્રાંતના કરવા ગયો. ૩૬પાછળથી, સિમોન અને તેના ભિત્રો ઈસુની શોધમાં નીકળ્યા. ૩૭તેઓએ ઈસુને શાય્યો અને કહ્યું, "બધા જ લોકો તારી રાહ જોઈ રહ્યા છે!"

૩૮ઈસુએ જવાબ આપ્યો; "આપણો બીજુ કોઈ જગ્યાએ જતું જાઈએ. આપણો અહીંના આજુબાજુના બીજો ગામોમાં જઈએ, હું તે સ્થળોએ પણ ઉપદેશ આપી શકું તે માટે હું આવ્યો છું." ૩૯તેથી ઈસુએ ગાલીલેમાં સર્વત્ર મુસાફરી કરી. સભાસ્થાનમાં તેણે ઉપદેશ કર્યો, અને તેણે દુષ્ટાત્માઓને લોકોને છોડીને જવા ફરજ પાડી.

ઈસુનું માંદા માણસને સાજા કરવું

૪૦એક માણસ કે જેને કોષ હતો તે ઈસુ પાસે આવ્યો. તે માણસે ઘૂંઠા ટેકવીને ઈસુને વિનંતી કરી. "તું ઈચ્છે તો તું મને સાજો કરવા સર્વત્ર છે."

૪૧ઈસુને આ માણસ માટે દયા આવી. તેથી ઈસુએ તે માણસને સ્પર્શ કર્યાં અને કહ્યું, "હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ છું!" ૪૨પછી માંદળી તે માણસને છોડી ગઈ અને તે સાજો થઈ ગયો.

૪૩ઈસુએ તે માણસને જવાનું કર્યું. પણ ઈસુએ તેને કડક ચેતવણી આપી. ઈસુએ કહ્યું, ૪૪"મં તારા માટે જે કાઈ કર્યું તે વિષે તું કોઈ વ્યક્તિને કદીશ નહિ. પણ જ અને યાજકને જઈને બનતાવ. અને દેવને બેટ અર્પણ કર. ક્રારણ કે તું સાજો થઈ ગયો છે. મૂસાએ જે ફરમાન કર્યું છે તેની બેટ અર્પણ કર. આથી લોકોને સાક્ષી મળશે કે તું સાજો થઈ ગયો છે." ૪૫તે માણસ ત્યાંથી વિદાય થયો અને બધા લોકોને તેણે જોયા તે સર્વત્ર કર્યું કે ઈસુએ તેને સાજો કર્યો છે. તેથી ઈસુ વિષેના સમાચાર પ્રસરી ગયા. અને તેથી ઈસુ ફરી શહેરમાં ઉચાડી રીતે જઈ ન શક્યો. ઈસુ એવી જગ્યાઓએ રહ્યો જ્યાં લોકો રહેતા ન હતા. પરંતુ બધા શહેરોના લોકો ઈસુ જે જગ્યાએ હતો ત્યાં આવ્યા.

ઈસુનું પક્ષધાતી માણસને સાજા કરવું

૨ થોડા દિવસો પછી, ઈસુ કરી પાછો કફર-નહૂમમાં આવ્યો. તે સમાચાર પ્રસરી ગયા કે ઈસુ ઘેર પાછો કર્યો હતો. વધા ભધા લોકો ઈસુનો ઉપદેશ સાંભળવા ભેગા થયા હતા. ઘર ભરેલું હતું ત્યાં દરવાજા બહાર પણ ઊભા રહેવાની જગ્યા ન હતી. ઈસુ આ લોકોને ઉપદેશ આપતો હતો. કેટલાક લોકો એક પક્ષધાતી માણસને ઈસુ પાસે લાવ્યા. ચાર માણસો તે પક્ષધાતી માણસને ઊચકીને લાવતાં હતા. રેપણ તેઓ તે માણસને ઈસુ પાસે લાવી શકત્યા નહિ કારણ કે ઘર લોકોથી ભરેલું હતું તેથી તે માણસો ઈસુ જ્યો હતો તે છાપરા પર ગયા અને છાપરામાં બાકોનું પાડયું પછી તેઓએ પક્ષધાતી માણસ જે ખાટલામાં પડેલો હતો તે ખાટલો નીચે ઉત્તર્યો. ઈસુએ જ્યો કે આ માણસોને ખૂબ વિશ્વાસ છે, તેથી તે પક્ષધાતી માણસને કર્યું, “જુવાન માણસ, તારો પાપો માફ થયાં છે.”

“કેટલાક શાસીઓ ત્યાં બેઠેલા હતા. ઈસુએ જે કર્યું તે તેઓએ જ્યો, અને તેઓએ તેઓની જીતને કર્યું. “આ માણસ આમ કેમ કહે છે? તે જે કહે છે તે દેવની વિરુદ્ધ છે. ફક્ત દેવ જ પાપોને માફ કરી શકે.”

ઈસુએ જ્યો કે આ શાસીઓ તના વિષે આવી બાબતો વિચારતા હતા. તેથી ઈસુએ તેઓને કર્યું, “તમારા મગજમાં આવા વિચારો કેમ આવે છે? આ પક્ષધાતી માણસને શું કહેવું સરળ છે, તારો પાપ માફ થયા છે, કે તેને કર્યું, ઊભો થા, તારી પથારી લઈને ચાલ? કે-૧૦ પણ હું તમને સાબિત કરાવી આપીશ કે માણસના પુત્રને પૃથ્વી પર પાપો માફ કરવાનો અધિકાર છે.” તેથી ઈસુએ પક્ષધાતી માણસને કર્યું, “હું તને કહુ છું, “ઊભો થા, તારી પથારી ઊચકીને તારે ઘેર ચાલ્યો જા.” જે પક્ષધાતી માણસ ઊભો થયો. તેણે તેની પથારી લીધી અને ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. ભધા લોકો તેને જોઈ શકત્યા. લોકો નવાઈ પામ્યા અને દેવની સુતું કરી. તેઓએ કર્યું, “આજ સુધી ઊયેલી સૌથી આશ્રયકરક બાબત આ છે.”

ઈસુ ફીથી સરોવર પાસે ગયો. વધા માણસો ત્યાં તેને અનુસર્યા. તેથી ઈસુએ તેમને ઉપદેશ આપ્યો. ઈસુ સશેવરની બાજુમાંથી પસાર થતો હતો, ત્યાં અહીના દીકરા લેવીન જોયો. લેવી જગતનાક પર બઢો હતો. ઈસુએ તને કર્યું, “મારી પાછળ આવ,” પછી લેવી ઊભો થયો અને ઈસુની પાછળ ગયો.

૩૫૮ દિવસે મોદેથી ઈસુએ લેવીન ઘેર ભોજન કર્યું ત્યાં વધા જગતદારો હતા. અને બીજા ખરાબ લોકો ત્યાં

ઈસુ અને તેના શિષ્યો સાથે ભોજન કરતા હતા. ત્યાં આ લોકોમાંના વધા હતા જેઓ ઈસુને અનુસર્યા હતા. “શાસીઓએ (તેઓએ ફરેશીઓ હતા) ઈસુને જગતદારો અને બીજા ખરાબ લોકો સાથે બોજન કરતાં જોયો. તેઓએ ઈસુના શિષ્યોને પૂછ્યું, “શા માટે તે (ઈસુ) જગતદારો અને પાપીઓ સાથે ખાય છે?”

“ઈસુએ આ સાંભળ્યું અને તંશે તેઓને કર્યું, “તંદુરસ્ત માણસોને વેદની જરૂર પડતી નથી. પણ માંદ્ય માણસોને વેદની જરૂર પડે છે. હું સજજન લોકીને નિમંત્રણ આપવા આવ્યો નથી, હું પાપીઓને નિમંત્રણ આપવા આવ્યો છું.”

ઈસુનો અન્ય ધર્મિક આગેવાનો તરફનો અષાગમો

“થોહાનના શિષ્યો અને ફરેશીઓ ઉપવાસ કરતા હતા. કેટલાક લોકોએ ઈસુ પાસે આવીને કર્યું: “થોહાનના શિષ્યો ઉપવાસ કરે છે. અને ફરેશીઓના શિષ્યો પણ ઉપવાસ કરે છે. પણ તારા શિષ્યો ઉપવાસ કરતા નથી. શા માટે?”

“ઈસુએ જવાબ આપ્યો, “જ્યારે લગ્ન સમારંભ હોય છે ત્યારે વરસાજાના મિત્રો ઉદાસ હોતા નથી. તે તેઓની સાથે હોય છે ત્યારે તેઓ ઉપવાસ કરતા નથી. ૨૦૫ જ્યારે સમય આવશે ત્યારે વરસાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે. જ્યારે વરસાજા તેઓને હોડીને જ્યા છે ત્યારે તેઓ ઉદાસ હોય છે. પછી તેઓ ઉપવાસ કરશે.”

“જ્યારે વ્યક્તિન જૂના વસ્તા કાણા પર થીંગનું મારે છે ત્યારે તે કોરા કપડાનો ઉપયોગ કરતો નથી. જો તે તેમ કરે તો થીંગનું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢશે. અને તે કાણું વધારે ફાટે છે. ૨૨૮ અને લોકો કદાપિ નવો દ્રાક્ષારસ જુના દ્રાક્ષારસની મશકમાં રેડના નથી. શા માટે? કરાજ કે નવો દ્રાક્ષારસ, જુના દ્રાક્ષારસની મશકને ફાડી નામણે અને દ્રાક્ષારસ દ્રાક્ષારસની મશકો સાથે નાશ પામણે. લોકો હેમેશા નવો દ્રાક્ષારસ નવા દ્રાક્ષારસની મશકમાં ભરે છે.”

કેટલાક યહુદીઓ ઈસુની વીજા કરે છે

૨૪૭ વિશ્વામવારના દિવસે, ઈસુ કેટલાક અનાજના જેતરોમાંથી પસાર થતો હતો. ઈસુના શિષ્યો તેની સાથે ચાલતાં હતા. શિષ્યો કેટલાક કણસલાં તોડી આવ્યા લાગ્યા. ૨૫૯ ફરેશીઓએ આ જ્યો અને ઈસુને કર્યું; “તારા શિષ્યો તેમ શા માટે કરે છે? વિશ્વામવારના દિવસે તેમ કર્યું તે યહુદીઓના નિયમની વિરુદ્ધ છે.”

૨૫ઈસુઅ જવાબ આપ્યો, “જ્યારે દાઉદ અને તેની સાથેના લોકો ભૂખ્યા હતા અને તેઓને ભોજનની જરૂર હતી ત્યારે તેઓએ શું કર્યું હતું તે તમે વાંચ્યું છો? રોતે સમય દરમિયાન મૂખ્ય યાજક અભ્યાધાર હતો. દાઉદ દેવના ઘરમાં ગયો અને દેવને અર્પજા કરેલી રોટલી ખાધી. અને મૂસાનો નિયમ કહે છે, ફકત યાજકો જ તે રોટલી ખાઈ શક. દાઉદ તેની સાથેના પેલા લોકોને પણ રોટલીનો થોડો ભાગ આપ્યો.”

૨૬પછી ઈસુઅ ફરેશીઓને કહ્યું, “વિશ્વામવાર લોકોને મદદ કરવા બનાવાયો છે. વિશ્વામવારના શાસન માટે લોકોને બનાવવામાં આવ્યા નથી. ૨૭તી માણસનો પુત્ર એ દેરેક દિવસનો, વિશ્વામવારનો પણ પ્રભુ છે.”

ઈસુ માણસના સુક્રાયેલા હાથને સાઝો કરે છે

૩ બીજા એક સમયે ઈસુ સભાસ્થાનમાં ગયો. ત્યાં સભાસ્થાનમાં એક સુક્રાયેલા હાથવાળો માણસ હતો. કેટલાક યહૂદીઓ ઈસુને કહીક ખોટું કરતાં જોવા ઈચ્છા હતા, જેથી તેઓ તેના પર તહોમન મૂકી શક. તેથી તે લોકો તેમની નજીકથી ચોકી કરતા હતા. ઈસુ વિશ્વામવારના દિવસે તે માણસને સાઝો કરે છે કે નહિ તે તેઓ જોતા હતા. ઈસુઅ તે સુક્રાયેલા હાથવાળા માણસને કહ્યું, “અહીં તોબો થા જેથી બધા લોકો તેને જોઈ શકે.”

૪પછી ઈસુઅ લોકોને પૂછ્યું, “વિશ્વામવારના દિવસે કઈ વસ્તુ કરવી ઉચ્ચિત છે; જીનું કરવું કે ખરાખ કરવું? જીવ બચાવવો કે નાશ કરવો, શું ઉચ્ચિત છે?” લોકોએ ઈસુને જવાબ આપવા કર્યું કહ્યું નહિ.

૫ઈસુઅ લોકો તરફ જાયું, તે ગુરુસામાં હતો. પણ તેને ઘણું દુઃખ થયું. કારગ કે તેઓ કઠજા હદયના હતા. ઈસુઅ તે માણસને કહ્યું, “મને તારો હાથ જોવા દે.” તે માણસે તેનો હાથ ઈસુ આગળ લંબાવ્યો. અને તે સાઝો થઈ ગયો. ૬પછી ફરેશીઓ વિદાય થયા અને ઈસુને શી રીતે મારી નાખવો તે વિષે હેરોદીઓ સાથે યોજનાઓ કરી.

ઘણા લોકોનું ઈસુની પાછળ જતું

૭ઈસુ તેના શિષ્યોની સાથે સરોવર તરફ ગયો. ગાલીલમાંથી ઘણા લોકો તેની પાછળ ગયા. યહૂદીયામાંથી, યરૂશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી તથા તૂર તથા સિદ્ધાન્તની આસપાસના ઘણા લોકો તેણે જે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા. ઈસુઅ ઘણા લોકોને જોયા. તેથી તેણે તેના

શિષ્યોને નાની હોડી લાવીને તેને માટે તેથાર રાખવા કહ્યું. ઈસુને હોડી ઓઈતી હતી જેથી લોકોની ભીડના કારણે તે દબાઈ જાય નહિ. ૧૦ઈસુઅ ઘણા લોકોને સાંજ કર્યા. તેથી બધા જ માંદા લોકો તેનો સર્વર કરવા તેના તરફ ઘડેલાત હતા. ૧૧કેટલાક લોકોમાં શેતાન તરફથી અશુદ્ધ આત્મા હતો. જ્યારે અશુદ્ધ આત્માએ ઈસુને જોયો ત્યારે તેઓ તેને પગે પરીને બૂમો પાડવા લાગ્યા. “તું દેવનો દીકરો છે!” ૧૨પરંતુ ઈસુઅ તે આત્માઓને કડકાઈથી આજી કરી કે તે કોણ હતો તે લોકોને કહેવું નહિ.

ઈસુની તેના બાર પ્રેરિતોની પસંદગી

૧૩પછી ઈસુઅ ટેકરી પર ગયો. ઈસુઅ કેટલાક માણસોને તેની પાસે આવવા કહ્યું. ઈસુને જે માણસો ઓઈતા હતા તે આ હતા. આ માણસો ઈસુ પાસે ગયા. ૧૪ઈસુઅ બાર માણસો પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો કહ્યાં. ઈસુની ઈચ્છા આ બાર માણસો તેની સાથે રહે એવી હતી. અને તેની ઈચ્છા તેઓ બધાને જૂટી જૂટી જગ્યાએ ઉપદેશ માટે મોકલવાની હતી.

૧૫અને ઈસુની ઈચ્છા હતી કે આ માણસો લોકોમાંથી ભૂતોને બહાર કાઢવાનો અવિકાર પામે. ૧૬ઈસુઅ પસંદ કરેલા બાર માણસોના નામ આ છે. સિમોન (ઈસુઅ તેનું નામ પિતર આપ્યું). ૧૭ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન (ઈસુઅ તેઓને બને-રોસ એટલે “ગર્જાનાના પુરો” નામ આપ્યા); ૧૮આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થીરી તથા સિમોન કનાની તથા ૧૯યહૂદા ઈશ્કરિયોત કે જેણે ઈસુને દ્વારા દીવો.

કેટલાકનો ઈસુમાં શેતાન હોવાનો આશ્રેપ

૨૦પછી ઈસુ ઘેર ગયો. પણ ફરીથી ત્યાં ઘણા લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે ઈસુ અને તેના શિષ્યો ખાઈ શક્યા નહિ. ૨૧ઈસુના કુટુંબે આ બધી બાબતો વિષે સાંભળ્યું. તેઓ તેન પકડવા ગયા. કારગ કે લોકોએ કહ્યું કે, ઈસુ ઘેલો હતો.

૨૨યર્શાલેમના શાસીઓએ કહ્યું, “તેનામાં (ઈસુ) બાલજબૂલ (શેતાન) વસે છે ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.”

૨૩તેથી ઈસુઅ લોકોને બોલાવ્યા. અને લોકોને શીખવા વાર્તાઓને ઉપયોગ કર્યો. ઈસુઅ કહ્યું, “શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓને લોકોમાંથી બહાર કાઢવા દબાચ કરશે નહિ. ૨૪જે રાજ્ય તેની પોતાની

વિરુદ્ધ લડ છે તે ચાલુ રહી શકતું નથી. રૂપને જે પરિવારમાં ભાગવા પડે છે તે સફળ થઈ શકતું નથી. રૂપને જો શેતાન તેની જાતની વિરુદ્ધ હોય અને તેના પોતાના લોકો વિરુદ્ધ લડતો તે નખી શકતો નથી. તે શેતાનનો અંત હશે. રૂપો કોઈ વ્યક્તિની ઈચ્છા બળવાન માણસના ધરમાં પ્રવેસવાની અને તેના ધરમાંથી તેની વસ્તુઓનો ચોરી કરવાની હોય તો તે વ્યક્તિએ પહેલાં બળવાન માણસને બાધવો જાઈએ, પછીથી તે વ્યક્તિ ધરમાંથી વસ્તુઓ ચોરી શકશે. રૂપું તમને સત્ય કહું છું કે લોકના પાપો માફ થઈ શકે છે. અને લોકો દેવતીની વિરુદ્ધ જે બધી ખરાખ વાતો કહે તે પણ માફ થઈ શકે. રૂપજી જે કોઈ વ્યક્તિન પવિત્ર આત્માની વિરુદ્ધ ખરાખ વાતો કહે છે તે કદાપિ માફ થઈ શકશે નાહિએ. તે હુમેશા તે પાપ માટે દ્રોગિત રહેશે.”

રૂપનું આ કર્યું કરણ કે શાસીઓ કહેતા હતા કે ઈસુને અશુદ્ધ આત્મા વળગેલો છે.

ઈસુના શિષ્યો એજ તેનો સાચો પરિવાર

ઉપછી ઈસુની મા અને તેના ભાઈઓ આવ્યાં. તેઓ બહાર ઉભા રહીને ઈસુને બહાર આવવાનું કહેવા માટે એક માણસને મોકલ્યો. રૂપનું આજુભાજુ ઘણા બધા લોકો બેઠા હતા. તેઓએ તેને કહ્યું, “તારી મા અને તારા ભાઈઓ બહાર તારા માટે રાહ જુઓ છે.”

ઉપછી પૂછ્યું, “મારી મા કાણ છે? મારા ભાઈઓ કોણ છે?” ઉપછી ઈસું તેની આજુભાજુ બેઠાલા લોકો તરફ જોયું. તેણે કહ્યું, “આ લોકો મારી મા અને મારા ભાઈઓ છે! ઉપમારા સાચા ભાઈ અને બહેન અને મા એ લોકો છે જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે.”

બી વાવનારની વાર્તા ઈસુ સમજાયે છે

બીજુ એક વખત ઈસુએ સરોવરની બાજુમાં ઉપદેશ શરૂ કર્યો. ઘણા બધા લોકો ઈસુની આજુભાજુ ભેગા થયા. તેથી તે હોડીમાં ચટપો અને ત્યાં બેઠો. બધા જ લોકો પાણીની બાજુમાં સમુદ્રને કોઠે રહ્યા. ઈસુએ હોડીમાંથી જ લોકોન ઉપદેશ આવ્યો. ઈસુએ તેઓને શીખવવા માટે ઘણી વાતાનોનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું, “ધ્યાનથી સાંભળો! એક બેદૂત તેના બી વાવવા માટે બહાર નીકળ્યો. જ્યારે બેદૂત વાવતો હતો, કટલાક બી સરનાની બાજુએ પહ્યા. પક્ષીઓ આવ્યાં અને પેલાં બધા બી ભાઈ ગયાં. કટલાક બી ખડકણ જમીન પર પડ્યા. જ્યાં પૂર્ણી માર્ટી ન હતી. ત્યાં બી ઘણા ઝડપથી ઊગ્યાં કારણ કે જમીન બહુ

ઉડી ન હતી. પણ સૂર્ય ઊગ્યો ત્યારે તે ધોડ કરમાઈ ગયો હતો. તે અંતે સુકાઈ ગયો. કારણ કે તેને ઉડા મૂળિયાં ન હતા. બીજા કટલાક બી કાંટાળા જાળામાં પડ્યા. કાંટાળા જાળાએ સારા છોડને ઉગાં અટકાયા. તેથી તે છોડોએ ફળ ન આપ્યું. કટલાક બીજા બી સારી જમીન પર પડ્યાં. સારી જમીનમાં તે બી ઊગવા માંડ્યાં. તે ઊગ્યા અને ફળ આપ્યાં. કટલાક છોડે ત્રીભગણાં, કટલાક છોડોએ સાઠગણાં અને કટલાક છોડોએ સોગણાં ફળ આપ્યાં.”

પછી ઈસુઅ કર્યું, “તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!”

ઈસુ કહે છે તે શા માટે વાર્તાઓનો ઉપયોગ કરે છે

“જ્યારે ઈસુએ એકાત્મમાં હતો ત્યારે બાર પ્રેરિતો અને ઈસુના બીજા શિષ્યોએ તેને વાર્તાઓ વિષે પૂછ્યું.

ઈસુઅ કર્યું, “તમે ફક્ત દેવના રાજ્ય વિષેનું સાચું રહસ્ય સમજુ શકો. પણ બીજા લોકોને હું બધી વસ્તુઓ વાર્તાઓનો ઉપયોગ કરી કહું છું. રૂપું આ કરું છું તેથી;”

‘તારો જોશ અને જોયા કરશે પરંતુ કદાપિ જોઈ શકશે નહિએ; તેઓ સાંભળશે અને સાંભળ્યાં કરશે, પણ કદાપિ સમજશે નહિએ. જો તેઓએ જોયું હોય અને સમજયા હોય તો, તેઓ પસ્તાવો કરે, ને તેઓને (પાપની) માર્દી મળે.’’

યશાયા ૬:૯-૧૦

બી વાવનારની વાર્તા ઈસુ સમજાયે છે

ઉપછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે આ વાર્તા સમજાયા? જો તમે ના સમજયા હોય તો પછી તમે બીજુ કઈ વાર્તા સમજુ શકશો? રૂપેદૂત એ એક વ્યક્તિ છે જે લોકોમાં દેવના વચનને વાવે છે. પણ કટલાક લોકો જંબું છે. તે લોકો દેવનું વચન સાંભળે છે. પરંતુ શેતાન આવે છે અને વચન લઈ જાય છે જે તેઓનામાં વવાયેલું હતું. બીજા લોકો પથ્થરવાળી જમીનમાં વાવેલાં બીજ જવા છે. તેઓ વચન સાંભળે છે અને તેનો આનંદથી તરત જ સ્વીકાર કરે છે. પણ આ લોકો વચનને તેમના જીવનમાં ઉડા ઉત્તરવા દેતા નથી. તેઓ આ વચનને ફક્ત થાડી વાર માટે રામે છે. જ્યારે મુશ્કેલી અથવા સતાવણી વચનને કારણે આવે છે ત્યારે તેઓ તરત ઢોકર ખાય છે. બીજા કટલાક લોકો કાંટાળા જાળામાં વાવેલાં બીજ જવા છે. આ લોકો વચન સાંભળે છે.

૧૯પણ પછી તેમના જીવનમાં આવી બાબતો આવે છે. જેવી કે આ જીવનની ચિંતાઓ, ખૂબ પેસાનો ખોટો મોહ, અને બીજુ બધી જ જાતની વસ્તુઓની ક્રામના. આ વસ્તુઓ વચનના વિકાસન અટકાવે છે. તેથી તે વચન તે લોકોના જીવનમાં ફણદાયી થતું નથી. ૨૦બીજા લોકો સારી જમીનમાં વાવેલાં બીજ જવા છે. તેઓ ઉપદેશ સાંભળે છે, સ્વીકારે છે અને ફળ આપે છે. કેટલીક વાર ત્રીસગણાં, કેટલીક વાર સાઠગણાં અને કેટલીક વાર સોગણાં ફળ આપે છે.”

તમારી પાસે જે હોય તેનો ઉપયોગ કરવો જોઈએ

૨૧પછી ઈસુએ તેઓને કહ્યું, “શુ માપ તમે અથવા ખાટલા તણે મૂકવા સારુ કોઈ દીવો રાખે છે? શુ દીવી પર મૂકવા નહિ? રૂજે બધુ સંતારેલું છે તે સ્પષ્ટ થશે. દરેક ગુપ્ત વસ્તુ પ્રગત કરવામાં આવશ. ૨૨તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!

૨૩“તમે જે સાંભળો તે વિષે ક્રાણજીપૂર્વક વિચારો. તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશો. પણ દેવ તમને, તમે જેટલું આપશો તેનાથી વધુ આપશો. રૂજે વ્યક્તિ પાસે કાંઈક છે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે વ્યક્તિ પાસે વધારે નથી, તે માણસ તેની પાસે જે કંઈ થાડું છે તે પણ ગુમાવશે.”

ઈસુની બીજની વાર્તાનો ઉપયોગ

૨૪પછી ઈસુએ કહ્યું, “દેવનું રાજ્ય એક માણસ જમીનમાં બીજ વાવે છે તેના જેવું છે. ૨૫બીજ ઉગવાની શરૂઆત કરે છે. તે રાત અને દિવસ ઊરે છે. તે મહત્વનું નથી કે માણસ ઊરે છે કે જાગે છે, હતાં પણ બીજ તા ઊરે છે; પણ તે શી રીતે ઊગ્યું તે જાગતો નથી. ૨૬કોઈ પણ જાતની મહદ વિના ભૌંય અનાજ ઉગાડે છે. પ્રથમ છોડ ઊરે છે. પછી ક્રાસલું અને ત્યાર બાદ ક્રાસલાન્ના બધા દાઢા ભરાય છે. ૨૭જાયારે દાઢા તેયાર થાય છે, ત્યારે માણસ તેને કાપે છે. આ સમય કાપણીનો છે.”

દેવનું રાજ્ય રાઈના દાઢા જેવું છે

૨૮પછી ઈસુએ કહ્યું, “દેવનું રાજ્ય શાના જેવું છે એ તમને બતાવવા હું શાનો ઉપયોગ કરી શકું? તે સમજાવવા માટે હું કરી વાતાનો ઉપયોગ કરી શકું? ૨૯દેવનું રાજ્ય એક રાઈના બી જેવું છે જ તમે જમીનમાં વાવો છો. તે સર્વ બી કરતાં નાનામાં નાનું બી છે. ૩૦પણ જ્યારે તમે આ બી વાવો છો, તે ઊરે છે અને તમારા બાગના બધા જ છોડવાઓમાં સોથી મોટો છોડ બને છે. તેને ખૂબ

મોટી ડાળીઓ હોય છે. ત્યાં આકાશનાં પક્ષીઓ આવી શકે છે અને માળાઓ બનાવી શકે છે અને સૂર્યથી રક્ષા મેળવી શકે છે.”

૩૧ઈસુએ તેમને શીખવવા માટે આવી ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો, જેથી તેઓ દરેક બાબત સમજુ શકે. ૩૨ઈસુ હુમેશા લોકોને શીખવવા માટે વાર્તાઓનો જ ઉપયોગ કરતો. પણ જ્યારે ઈસુ અને તેના શિષ્યો એકલા બેગા થતા ત્યારે ઈસુ તેઓને દરેક વાતાનો ખુલાસો કરતો.

ઈસુનું તોકાનને અટકાવતુ

૩૩એ દિવસે સાંજે ઈસુએ તેના શિષ્યોને કહ્યું “ચાલો, આપણે સરોવરને પેલે પાર જઈએ.” ૩૪ઈસુ અને શિષ્યોએ લોકોને ત્યા છોડા. ઈસુ જેમાં બેઠા હતો તે જ હોડીમાં તેઓ ગયા. ત્યા તેની સાથે બીજુ હોડીઓ પણ હતી. ૩૫સરોવરમાં પવનનું મોટું તોકાન થયું. મોઝાઓ ઉપરની બાજુઓ પર અને હોડીની અંદર આવા લાયાં. હોડી લગભગ પાણીથી ભરાઈ ગઈ હતી. ૩૬ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓસીકા પર તેનું માથું ટેકવીને ઊંઘતો હતો. શિષ્યો તેની પાસે ગયા અન તેને જગાડીન કહ્યું, “ઉપદેશક, તને અમારી ચિંતા નથી? આપણે દૂબી જઈશું!”

૩૭ઈસુ ઊભો થયો અને પવનને અને મોંજાઓને અટકી જવા આશા કરી, ઈસુએ કહ્યું, ધાનો રહે, શાંત થા!” પછી પવન અટકી ગયો અને સરોવર શાંત થઈ ગયું.

૩૮ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમે શા માટે ડરો છો? શુ તમને હજું યેવિશાસ નથી?”

૩૯શિષ્યો થથા ડરી ગયા હતા અને એકબીજાને પૂછતા હતા કે, “આ માણસ કેવા પ્રકારનો છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?”

ઈસુ ભૂત વળગેલા માણસને મુક્ત કરે છે

૪ ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરીને ગેરસાની લોકો રહેતા હતા તે પ્રદેશમાં ગયો. ૪૨જારે ઈસુ હોડીમાંથી નીચે ઉત્તો ત્યારે જ્યાં મરેલા માણસોને દાટવામાં આવે છે તે ગુજરાતોમાંથી એક માણસ તેમની પાસે આવ્યો. આ માણસને ભૂત વળગેલ હતું. તે માણસ કબરસાનાની ગુજરાતોમાં રહેતો હતો. સાંકળો પણ આ માણસને બાંધી શકતો ન હતો. બાંધી વાર લોકોએ તે માણસના બાંધ પગ બાંધવા સાંકળનો ઉપયોગ કર્યો.

પણ તે માણસ તેના હાથપગથી સાંકળો તોડી નાખતો. કોઈ માણસ તેને કાબુમાં રાખવા પૂરતો સમર્થ ન હતો. પરંતુ ટિવિસ તે માણસ કબરસ્તાનની ગુજરાતીઓની આસપાસ અને ટેકરીઓની પર ચાલતો હતો. તે માણસ ચીસો પાડતો અને પથ્યરોથી પોતાને ઘાયલ કરતો.

“જ્યારે ઈસુ ઘણો દૂર હતો ત્યારે તે માણસ તેને જોયો. તે માણસ ઈસુ પાસે દોડી ગયો અને તેની આગળ ઘૂંઠણીએ પડ્યો. ૧૯ઈસુએ તે માણસને કહ્યું “ઓ અશુદ્ધ આત્મા, તે માણસમાંથી બહાર નીકળ.” તેથી તે માણસે મોટા અવાજ વાંટો પાડ્યો, “ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસે શુ ઈંછે છુ? હુ તને દેવના સોંગ દઈ છુ, તું મને શિક્ષા નહિ કરે!”

“પછી ઈસુએ તે માણસને પૂછ્યું, “તારું નામ શુ છુ?”

તે માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના* છે. કેમ કે મારામાં ઘણા આત્માઓ છે.” ૨૦તે માણસમાં રહેલા આત્માઓએ ઈસુને વારંવાર વિનંતી કરી કે તેઓને તે પ્રદેશમાંથી બહાર ન કઢે.

“ત્યાં નજીકમાં એક ભૂંડનું મોટું ટોળું ટેકરીઓની બાજુમાં ચરતું હતું. ૨૧અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, “અમને ભૂંડમાં મોકલ, અમને તેઓમાં મોકલ.” ૨૨તેથી ઈસુએ તેઓને રજા આપી. અશુદ્ધ આત્માઓએ માણસને છોડ્યો અને તેઓ ભૂંડમાં ગયા. પછી તે ભૂંડનું ટોળું ટેકરીઓની કરાડો પરથી ઘસી ગયું અને સરોવરમાં પડી ગયું. બધા જ ભૂંડો રૂની ગયા. તે ટોળામાં લગભગ ૨,૦૦૦ ભૂંડો હતાં.

૨૩ માણસો ભૂંડની સંભાળ રાખવાનું કામ કરતા હતા તે નાચી ગયા. તે માણસો ગામમાં ગયા અને ખેતરોમાં દોડી ગયા. તેઓએ બધા લોકોને જે બન્યું હતું તે કહ્યું તેથી જે બન્યું હતું તે જોવા માટે તેઓ આવ્યા. ૨૪લોકો ઈસુ પાસે આવ્યા. તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો. તે માણસ બેદી હતો અને વસો પહેરેલો હતો. તેનું મગજ ફીથી સ્વસ્થ હતું. લોકો બયબીત થયા હતા. ૨૫કેટલાક લોકો ત્યાં હતા અને ઈસુએ જે કર્યું તે જોયું હતું. તે લોકોએ બીજા લોકોને પેલો માણસ જેનામાં દુષ્ટાત્મા હતો તેનું શુ થયું તે કહ્યું અને તેઓએ ભૂંડ વિષે પણ કહ્યું. ૨૬પછી તે લોકો ઈસુને તેમનો પ્રદેશ છોડી જવા વિનંતી કરવા લાગ્યા.

૨૭ઈસુ હોડીમાં બેસવા જતો હતો. અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે ઈસુ સાથે જવા વિનતી કરી.

૨૮પછા ઈસુએ તે માણસને સાથે આવવાની ના પાડી. ઈસુએ કહ્યું, “તારે ઘેર તારા સગાંચો પાસે જી, પ્રભુએ તારા માટે જે બધું કર્યું તે વિષે તેઓને કહે. તેમને જ્યાબ કે પ્રભુ તારા માટે દયાળું હતો.” ૨૯તેથી તે માણસે વિદાય લીધી અને તેના માટે ઈસુએ જે મહાન કાર્ય કર્યા તે વિષે દશનગર* માં લોકને કહ્યું. બધા લોકો નવાઈ પામ્યા.

ઈસુનું મૃત છોકરીને સજીવન કરવું

અને બિમાર સીને સાજુ કરવી

૨૧ઈસુ હોડીમાં બસી સરોવર ઓળંગીને તેની બીજી બાજુએ ગયો. સરોવરની બાજુમાં તેની આજુબાજુ ઘણા લોકો ભેગા થયા હતા. ૨૨સભાસ્થાનના આગેવાનોંમાંનો એક ત્યાં આવ્યો. તેનું નામ યાઈર હતું. યાઈર ઈસુને જોયો અને તેની આગળ પગે પડ્યો. ૨૩યાઈર ઈસુને ઘણી આજુજી કરીને કહ્યું, “મારી નાની દીકરી મરણપથરી પર છે. કૃપા કરીને તારો હાથ તેના પર મૂક. પછી તે સાજુ થઈ જશે અને જીવશે.”

૨૪તેથી ઈસુ યાઈર સાથે ગયો. ઘણા લોકો ઈસુની પાછળ ગયા. તેઓ તેની આજુબાજુ ઘણા નજીક હોવાથી દક્કા દક્કી થઈ હતી.

૨૫લોકો મધ્યે એક સી હતી. આ સીને છંલ્લા બાર વર્ષાથી લોહીવા હતો. ૨૬તે સીએ ઘણું સહન કર્યું હતું. ઘણા વેદોએ તેનો ઇલાજ કરવા પ્રયત્ન કર્યો હતો. તેની પાસેના બધા પેસા ખર્યાઈ ગયા પરંતુ તેનામાં સુધારો થતો ન હતો. તેની બિમારી વધતી જતી હતી. ૨૭તે સીએ ઈસુ વિષે સાંભળ્યું. તેથી તે ટોળામાંથી ઈસુની પાછળ લોકો સાથે ગઈ. અને તેના જભાને અડકી. ૨૮તે સીએ વિચાર્યું, “જો હુ તેના કપડાને પગ સ્પર્શ કરીશ તો તે મને સાજુ કરવા પૂરતું છે.” ૨૯જ્યારે તે સી તેના જભાને અડકી, ત્યારે તરત તેનો લોહીવા અટકી ગયો. તે સીને લાઘું કે તેનું શરીર દર્દમાંથી સાજુ થઈ ગયું છે. ૩૦ઈસુએ જાણ્યું કે તેનામાંથી સામર્થ્ય બહાર નીકળ્યું. તેથી તે ટોળા તરફ ફર્યો અને પૂછ્યું, “મારા લગ્નાન કોણે સર્પશ કર્યો?”

સેના આનો અર્થ ઘણા થાય છે. ઉમી લશ્કરમાં ૫,૦૦૦ માણસોની સેના હોય છે.

દશનગર ‘દીક્રાપોલીસ’ ગાલીલના સરોવરની પૂર્વ તરફ આ પ્રદેશ આવેલો છે. એક સમયે ત્યાં મુખ્ય દશ નગરો હતાં.

જાણિયોએ ઈસુને કહ્યું, “તું જુએ છે કે ઘણા લોકો તારી પર પડાપડી કરે છે અને તું પૂછે છે કે, ‘મને કોણે સ્પર્શ કર્યો?’”

ઉપરાતુ જે વ્યક્તિએ ઈસુને સ્પર્શ કર્યો તેને જોવાનું ઈસુએ ચાલુ રાખ્યું. ઉત્તે સીએ જાણ્યું કે તે સાજુ થઈ ગઈ હતી. તથી તે આવી અને ઈસુના પગે પડી. તે સી ભયથી ધૂજતી હતી. તેણે ઈસુને આખી વાત કહી. ઈસુએ તે સીને કહ્યું, “તને સાજુ કરવામાં આવી છે કારણ કે તને વિશ્વાસ છે. શાંતિથી જા. હવે તારે વધારે સહન કરવાનું નહિ રહે.”

ઉપરાતુ હજુ બોલતો હતો તેટલાક માણસો યાઈર જે સભાસ્થાનનો આગેવાન છે તેના ધરમાંથી આવ્યો. તે માણસોએ કહ્યું, “તારી દીકરી મૃત્યુ પામી છે. તથી હવે ઉપદેશકને (ઈસુ) તસ્વી આપવાની જરૂર નથી.”

ઉમાશસો શું કહે છે તેની ચિંતા પણ ઈસુએ કરી નહિ. ઈસુએ સભાસ્થાનના આગેવાનને કહ્યું, “ગભરાઈશ નહિ; માત્ર વિશ્વાસ રાખ.”

ઉદ્દીસુએ ફક્ત પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને પોતાની સાથે આવવા દીધા. ઉદ્દીસુએ આ શિષ્યો યાઈર જે સભાસ્થાનનો આગેવાન હતો તેને ઘેર ગયા. ઈસુએ ઘણા લોકોને મોટે સાદે રડતા જોયા. ત્યા ઘણી મુજબણ હતી. ઉદ્દીસુએ ધરમાં પ્રવેશીને લોકોને કહ્યું, “તમે લોકો શા માટે રડો છો અને આટલો બધો ઘોધાટ કરો છો? આ બાળક મરી ગયું નથી. તે તો ફક્ત ઉદ્ધિ છે.” ૧૦૦પણ બધા લોકો ઈસુ તરફ હસ્યા. ઈસુએ લોકોને ધરની બહાર જવા કહ્યું પછી ઈસુ બાળક જે ઓરડામાં હતું ત્યા ગયો. તે બાળકના માતાપિતા અને તેના ત્રણ શિષ્યોને તેની સાથે ઓરડામાં લાવ્યા. ૧૧પછી ઈસુએ છોકરીનો હથ પકડ્યો અને તેને કહ્યું, “ટલિથા કૂમ!” (આનો અર્થ, “નાની છોકરી, હું તને તીબી થયા કરું છું.”) ઉત્તે છોકરી તીબી થઈ અને ચાલવા લાગી. (તે છોકરી બાર વરસની હતી.) પિતા, માતા અને શિષ્યો ખૂબ અચરજ પામ્યા હતા. ઉદ્દીસુએ પિતા અને માતાને કહક હુકમ કર્યો કે લોકોને આ વિષે કહેવું નહિ. પછી ઈસુએ તે છોકરીને થોડું ખાવાનું આપવા તેઓને કહ્યું.

ઈસુનું તેના વતનમાં ગમન

૬ ઈસુ ત્યાંથી વિદાય લઈન પાછો તેના વતનમાં આવ્યો. તેના શિષ્યો તેની સાથે ગયા. વિશ્વામવારના દિવસે ઈસુએ સભાસ્થાનમાં ઉપદેશ આપ્યો. ઘણા લોકો તેનો ઉપદેશ સાંભળીને નવાઈ

પામ્યા. આ લોકોએ કહ્યું, “આ માણસે આ ઉપદેશ ક્યાંથી મેળવ્યો? તેને આ ડાપણ કેવી રીતે મળ્યું? તે તેને કોણે આપ્યું? અને આવા પરાકમો કરવાની તાકાત તેણે ક્રાંતી મેળવ્યી? તે તો ફક્ત એક સુતાર છે. અને તેની મા મરિયમ છે. તે યાકૂબ, યોસે યહૂદા અને સિમોનનો ભાઈ છે અને તેની બહેનો અર્ડી આપજી સાથે છે.” તે લોકોએ ઈસુનો સ્વીકાર કર્યો નહિ.

ઈસુએ લોકોને કહ્યું, “બીજા લોકો પ્રબોધકને સન્માન આપે છે પણ તના પોતાના ગામમાં, તેના પોતાના લોકો સાથે અને પોતાના ધરમાં પ્રબોધકને સન્માન મળતું નથી.” ઈસુ એ તે ગામમાં વધારે પરાકમી કામ કર્યા નહિ. તેણે જે પરાકમો કર્યા તે તો માત્ર કેટલાક બીમાર લોકો પર તેનો હાથ મૃકી સાંજ કર્યા હતો. ઈસુને ઘણું આશ્રય થયું હતું કારણ કે પેલા લોકોને વિશ્વાસ ન હતો.

પછી ઈસુએ તે પ્રદેશના બીજા ગામોમાં જઈને ઉપદેશ આપ્યો. ઉદ્દીસુએ બાર શિષ્યો ને સાથે બોલાવ્યા. ઈસુએ તેઓને બધ્યે જગાને બહાર મોકલ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું તે આ છે: “તમારી યાત્રા માટે કોઈ લેવું નહિ. ચાલવા માટે ફક્ત એક લાકડી સાથે લો, રોટલી નહિ, થેલી નહિ, અને તમારા જિસ્સામાં પેસા નહિ. જોડા પહેરો અને ફક્ત પહેરેલા વસો જ રાખો. ૧૦જ્યારે તમે ધરમાં પ્રવેશો ત્યારે જ્યાં સુધી તે જ્યા ધોડો ત્યાં સુધી તે ધરમાં જ રહો. ૧૧ણે કોઈ ગામ તમને સ્વીકારવા ના પાડે અથવા તમને સાંભળવા ના પાડે તો તે ગામ છોડી જાઓ. તમારા પગને લાગેવી ધૂળ ખંખેરી નાખો. આ તેઓને માટે એક ચેતવણી હશે.”

૧૨ શિષ્યો ત્યાંથી વિદાય થયા અને બીજી જ્યાએ ગયા. તેઓએ લોકોને ઉપદેશ આપ્યો અને તેઓને પસ્તાવો કરવા કહ્યું. ૧૩ તે શિષ્યોએ ઘણાં ભૂતોને લાગેમાંથી કાટયાં અને તેમણે ઘણાં માટાં લોકોને આદિવ તેલ ચોળી સાંજ કર્યા.

હેરોદ માને છે ઈસુ એ જ બાપ્તિસ્મા કરનાર યોહાન છે

૧૪હેરોદ * રાજાએ ઈસુ વિષે સાંભળ્યું, કારણ કે હવે ઈસુ પ્રાણ્યાત થઈ ગયો હતો. કેટલાક લોકોએ કહ્યું, “તે (ઈસુ) બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે મૃત્યુમાંથી ઊંઠ્યો છે. તેથી તે આવાં પરાકમો કરી શક છે.”

હેરોદ અર્થાત હેરોદ અંતિપદ્ય, ગાલીલ અને પેરિનો રાજા તથા હેરોદ મહાનનો પુત્ર.

૧૪જીજા લોકોએ કહ્યું, “તે અખિયા* છે.” બીજા લોકોએ કહ્યું, “ઈસુ એક પ્રભોઘક જેવો છે. લાંબા સમય પહેલા થઈ ગયેલા પ્રભોઘકો જેવા તે છે.”

૧૫હેરોટ ઈસુના વિષે આ વાતાં સાંબળી. તેણે કહ્યું, “મેં યોહાનને તેનું માથું કાપી નાંખી મારી નાંખ્યો. હવે તે યોહાન મૃત્યુમાથી સજીવન થયો છે!”

યોહાન બાપિસ્ટનું મૃત્યુ કેવી રીતે થયું

૧૬હેરોટ પોતે તેના સેનિકોને યોહાનને પકડવાનો હુકમ કર્યો હતો. તેથી યોહાન બંદીભાનામાં કેદ થયો હતો. હેરોટ તેની પત્નીને ખુશ કરવા આમ કર્યું હતું. હેરોટિયા હેરોદના ભાઈ ફિલિપની પત્ની હતી. પરંતુ પાછળથી હેરોટ હેરોટિયાને પરણ્યો. ૧૭યોહાને હેરોદન કહ્યું કે તેના માટે તેના ભાઈની પત્ની સાથે પરણવું તે ઉચિત નથી. ૧૮તેથી હેરોટિયાએ યોહાનને વિકાર્યો. તે તેને મારી નાખવા ઈચ્છની હતી. પરંતુ હેરોદને યોહાનને મારી નાખવાનું સમજાવવા માટે હેરોટિયા અશક્તિમાન હતો. ૧૯હેરોટ યોહાનની હત્યા કરતું ડર્સો હતો. હેરોટ જાણ્યું કે બધા લોકો ધારતા હતા કે યોહાન એક સારો અને પવિત્ર માશસ છે. તેથી હેરોટ યોહાનનું રક્ષણ કર્યું. હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવાનો આનંદ થયો. પણ યોહાનનો ઉપદેશ હેરોદને હમેશા ચિંતા કરાવતો.

૨૦પછી યોહાનના મૃત્યુના કરણ માટે હેરોટિયાને યોગ્ય સમય મળ્યો. તે હેરોદની વરસગાઠને દિવસે બન્યું. હેરોટ સૌથી મહત્વના સરકારી અવિકારીઓ, તેના લશકરી સેનાપતિઓ અને ગાલીલના ધણ અગત્યના લોકોને મિજબાની આપી. ૨૧હેરોટિયાની પુની મિજબાનીમાં આવી અને નાચી. જયારે તે નાચી ત્યારે હેરોટ અને તેની સાથે જમતા લોકો ધણ પ્રસન્ન થયા.

તેથી હેરોટ તે છોકરીને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંની શક છે અને હું તને તે આપિશ.” ૨૨હેરોટ તેણેને વચ્ચન આપ્યું, “તું ગમે તે માગીશ હું તને આપિશ. હું મારું અડધું રાજ્ય પણ તને આપિશ.”

૨૩ત છોકરી તેની મા પાસે ગઈ અને કહ્યું, “મારે રાજા હેરોદની પાસે શું માંગતું જોઈએ?” તેની માંને કહ્યું, “યોહાન બાપિસ્ટનું માથું માંગ.”

૨૪તે છોકરી ઝડપથી રાજા પાસે ગઈ, તે છોકરીએ રાજાને કહ્યું, “દૂપા કરીન મને યોહાન બાપિસ્ટનું માથું આપ. હમણાં થાળીમાં તે મારી પાસે લાવ.”

૨૫રાજા હેરોટ ધણો દિલગીર થયો. પણ તેણે છોકરીને

જે ઈચ્છે તે આપવાનું વચ્ચન આપ્યું હતું. અને ત્યા હેરોદની સાથે જમતાં લોકોએ તેનું વચ્ચન સાંભળ્યું હતું. તેથી હેરોટ તેણી જે માગે તનો અસ્વીકાર કરવા ઈચ્છાનો ન હતો. ૨૬તેથી રાજાએ યોહાનનું માથું શપીને લાવવા માટે સેનિકને મોકલ્યો. તેથી સેનિક બંદીભાનામાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું. ૨૭પછી તે સેનિક યોહાનનું માથું થાળીમાં પાઠું લાવ્યો. તેણે તે માથું છોકરીને આપ્યું. પછી તે છોકરીએ તે માથું તેની માને આપ્યું. ૨૮યોહાનના શિષ્યોએ જે બન્યું તેના વિષે સાંભળ્યું. તેથી તેઓ આવ્યા અને યોહાનનું ઘડ મેળવ્યું. તેઓએ તેને કબરમાં મૂક્યું.

ઈસુનું ૫,૦૦૦ થી વધારે માશસને જમાડવું

૩૦૪ પ્રેરિતોને ઈસુએ ઉપદેશ માટે મોકલ્યા હતા, તે ઈસુ પાસે પાછા આવ્યા. તેઓ ઈસુની આજુભાજુ ભેગા થયા અને તેઓએ જે બધી વસ્તુ કરી અને શીખવ્યું તે વિષે તેનું કહ્યું. ૩૧ઈસુ અને તેના શિષ્યો ધાળી ભીડવાળી જગ્યાએ હતો. અને ત્યાં ધાળા બધા લોકો હતા. ઈસુ અને તેના શિષ્યોને ખાવાનો સપચ પણ ન હતો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “મારી સાથે આવો આપણે એકાંત માટે શાંત જગ્યાએ જઈશું. ત્યાં આપણે થોડો આરામ કરીશું.”

૩૨તેથી ઈસુ અને તેના શિષ્યો એકલા દૂર ચાલ્યા ગયા. તેઓ હોડીમાં જ્યાં કોઈ લોકો ન હતા એવા નિર્જન સ્થળે ગયા. ૩૩પરંતુ ધાળા લોકોએ તેને જતા દીઠો. લોકોએ તેને ઓળખ્યો કે તે ઈસુ હતો તેથી જ્યાં ઈસુ જનો હતો તે સ્થળે બધાં ગામોમાંથી લોકો પગપાળા દીઠી ગયા. ઈસુના આવતા પહેલા લોકો ત્યાં હતા. ૩૪જારે ઈસુ ત્યાં આવ્યો, તેણે ધાળા માશસનો વાટ જોતા જોયા. ઈસુને તેમના માટે દુઃખ થયું, કરણ કે તેઓ સંભાળ રાખનાર ભરવાડ વિનાના વેંટા જેવા હતા. ઈસુએ લોકોને ધાળી વસ્તુઓ શીખવી.

૩૫પદે દિવસનો નમતો પહોર હતો. તેથી ઈસુના શિષ્યો તેના પાસે આવ્યા. તેઓએ કહ્યું, “આ જગ્યાએ કોઈ લોકો રહેતા નથી અને અત્યારે ધાંશું મોડું થયું છે, ૩૬તેથી લોકોને દૂર મોકલ્યો. તેઓ અહીના આસપાસના ગામોમાં અને ખેતરોમાં જઈને ખાવાનું ખરીટે.”

૩૭પદે ઈસુએ જવાબ આપ્યો, “તમે તેઓને થોડું ખાવાનું આપો.”

તે શિષ્યોએ ઈસુને કહ્યું, “આપણો આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલીઓ ખરીદી શકીએ તેમ નથી! આપણે બધાએ તેટલી રોટલીઓ ખરીદવા માટે એક મહીના સુધી ક્રમ કરીને પૂરતું કર્માં પડે.”

૩૯ઈસુઅં શિષ્યોને કહ્યું, "તમારી પાસે કેટલી રોટલીઓ છે? જાઓ અને જુઓ."

શિષ્યોએ તેઓની રોટલીઓ ગજી. તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું, "આપણી પાસે પાંચ રોટલી અને બે માછલીઓ છે."

૩૯પછી ઈસુઅં શિષ્યોને કહ્યું, "બધા લોકોને લીલા ધાસ પર જૂદા જૂદા જૂથોમાં બેસવા કહો." ૪૦તેથી બધા લોકો સમુહમાં બેઠા, કેટલાક જૂથોમાં એકસો માશસો હતા તો કેટલાક જૂથોમાં પચાસ માશસો હતા. ૪૧ઈસુઅં પાંચ રોટલી અને બે માછલીઓ લીધી તેણે ઊંચ આકર્ષણમાં જોયું અને રોટલી માટે દેવનો આભાર માન્યો. પછી ઈસુઅં તે રોટલીના ટુકડા કર્યા અને તે તેના શિષ્યોને આપ્યા. ઈસુઅં તેના શિષ્યોને તે રોટલી લોકોને આપવા કહ્યું. પછી ઈસુઅં બે માછલીના ભાગ કર્યા અને લોકોને માછલી આપી. ૪૨આમ લોકોએ ખાદું અને તૃપ્તા થયા. ૪૩લોકોએ ખાવાનું પૂરું કર્યા બાદ શિષ્યોએ છાંડેલા રોટલીના ટુકડાઓથી અને માછલીઓથી બાર ટોપલીઓ ભરી. ૪૪ત્યાં લગભગ ૫,૦૦૦ પુરુષોએ ભોજન કર્યું.

ઈસુ પાણી પર ચાલે છે

૪૫પછી ઈસુઅં શિષ્યોને હોડીમાં બેસવા માટે કહ્યું, ઈસુઅં તેમને બેથસેદાની પેલે પાર સરોવરની બીજી બાજુઅં જવા માટે કહ્યું. ઈસુઅં કહ્યું કે તે પાછળાથી આવશે, ઈસુઅં લોકોને તેમના ધર તરફ જવાનું કહ્યું. ૪૬લોકોને શુભ વિદાય કર્યાં પછી ઈસુ ટેકરી પર પ્રાર્થના કરવા ગયો.

૪૭તે રાત્રે, હોડી હજુ પણ સરોવરની મધ્યમાં હતી. ઈસુ ભૂમિ પર એકલો હતો. ૪૮ઈસુઅં સરોવરમાં હોડીને દૂર દૂર જોઈ. તેણે શિષ્યોને હોડીના હેલેસા મારવામાં સખત મહેનત કરતો જોયા. પવન તેમની વિરુદ્ધ કૂકાતો હતો. સવારે ગત્ય થી છ કલાકના સમયે, ઈસુઅં પાણી પર ચાલવાનું ચાલુ રાખ્યું, અને તે તેમની બાજુમાંથી પસાર થતો હતો. ને જોં તેઓથી આગળ જવાનું તેણે કહ્યું. ૪૯પરંતુ શિષ્યોએ ઈસુને પાણી પર ચાલતો જોયો. તેઓએ ધાર્યું કે, એ તો આભાસ છે. શિષ્યો ભયથી બૂમો પાડવા લાગ્યા. ૫૦બધા શિષ્યોએ ઈસુને જોયો અને તેઓ ઘણા ભયથી આગળ થતી અને પવન તેઓએ ઈસુઅં શિષ્યોને કહ્યું, "હિંમત રાખો. તે હું જ છું, ગમબારથો નહિ," ૫૧પછી ઈસુ શિષ્યો સાથે હોડીમાં પ્રવેશ્યો અને પવન શાંત થઈ ગયો. તે શિષ્યો તો સંપૂર્ણ આશ્રય પામ્યા. ૫૨તેઓએ ઈસુને પાંચ રોટલીમાંથી વધારે રોટલી

બનાવતા લોયો હતો. પણ તેઓ સમજું શક્યા ન હતા. તેનો અર્થ શું છે. તેઓ તે સમજવા માટે શક્તિમાન ન હતા.

૫૩ઈસુના શિષ્યોએ સરોવરને ઓળંગ્યુ. તેઓ ગન્નેસરેતના દરિયા ડિનારે આવ્યા. તેઓએ ત્યાં હોડી લાંગરી. ૫૪જયારે તેઓ હોડીની બહાર હતા. ત્યારે લોકોએ ઈસુને જોયો. તેઓએ જ્ઞાન્યું કે તે દોઢા હતા. ૫૫આખા પ્રદેશમાં દોડી જઈને લોકોને જગ્યાયું કે ઈસુ ત્યાં છે. લોકો માંદા માશસોને ખાટલામાં લાવ્યા. ૫૬ઈસુ તે પ્રદેશના આસપાસનાં ગામો, શહેરો અને ખેતરોમાં ગયો અને દેક જાયાએ ઈસુ ગયો. ત્યાં તે લોકો જિમાર લોકોને બજારના સ્થળોએ લાવ્યા. તેઓ ઈસુને તેનાં જભાની કીનારને પણ રૂપર્શ કરવા દેવા માટે વિનંતી કરી. અને બધા લોકોએ જેમણે સ્પર્શ કર્યા તે સર્વ સાંન થઈ ગયા.

દેવના નિયમો અને લોકોએ બનાવેલા કાયદાઓ

૭ કેટલાએક ફરોશીઓ અને કેટલાએક શાસ્ત્રીઓ યદ્રાલેમાંથી આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગ થયા. ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુના કેટલાએક શિષ્યોને ગંદા હથો વડે ખાતાં જોયા. ("ચોખા નહિ" નો અર્થઃ-ફરોશીઓ લોકોને આગ્રહ કરતા કે જે અમુક રીતે તેમના હાથ ધોવા જોઈએ તે રીતે ધોયા ન હતા.) ઉફરોશીઓ અને બધા યહૂદીઓ તેમની વિશીષ રીતે હાથ ધોયા વિના કદાપિ ખાતા નથી. તેઓ તેમની અગાઉ થઈ ગયેલા મહાન લોકોએ આપેલા ઉપદેશને અનુસરવા આ કરતા. ૪અને જ્યારે યહૂદીઓ બજારમાંથી કાઈક ખરીદે છે. ત્યારે તેઓ તેને ખાસ રીતે ધુએ નહિ ત્યા સુધી તેઓ કદી ખાતા નથી. તેઓ તેમની અગાઉ જે રહેતા હતા તે લોકોના બીજા નિયમોને પણ અનુસર્યા. તેઓ પ્રાલાઓ, ઘઢાઓ અને ગાગરો ધોવા જેવા નિયમોને પણ અનુસરે છે.

૫ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુને કહ્યું, "તારા શિષ્યો અમારા મહાન લોકો જે અમારી અગાઉ જુવી ગયા તેઓએ અમને આપેલા નિયમોને અનુસરતા નથી. તારા શિષ્યો જે હાથો ચોખ્યા નથી તેના વડે તેમનું ખાવાનું ખાય છે. તેઓ આમ શા માટે કરે છે?"

૬ઈસુઅં જવાબ આપ્યો, "તમે બધા દંબી છો. યશાયા તમારા વિષે સાચું જ કહે છે. યશાયાને લાખ્યું છે, 'આ લોકો કહે છે તેઓ મને માન આપે છે, પણ તેઓ ખરેખર મને તેમના જુવનનો મહત્વનો ભાગ બનાવતા નથી.'

૧ તએ મારી બહિત વ્યર્થ કરે છે. જે વસ્તુઓનો
તએ ઉપદેશ કરે છે તે તો લોકોએ બનાવેલા
ફક્ત સાદા નિયમો છે.’

વશાયા ૨૮:૭૩

તમે દેવની આશાને અનુસરવાનું બંધ કર્યુ છે. હવે
તમે માણસોના ઉપદેશો અનુસરો છો.”

૨૮થી ઈસુએ તએને કહ્યું, “તમે ધારો છો કે તમે
ચાલાક છો! તમે દેવની આશા અવગાણો છો જેથી તમે
તમારા પોતાના ઉપદેશને અનુસરી શકો. ૧૦ મૂસાએ કહ્યું;
‘તમારે તમારા માતાપિતાને માન આપવું જોઈએ.’ પણ
મૂસાએ કહ્યું, ‘જે કોઈ વ્યક્તિ તેના પિતા કે માની નિંદા
કરે તેને મારી નાખવો જોઈએ.’ ૧૧ પણ તમે ઉપદેશ
આપો છો કે વ્યક્તિ તેના પિતા અને માને કહી શક,
‘મારી પાસે થોડુક છે હું તમને મદદ કરવા માટે તેનો
ઉપયોગ કરી શકું પણ હું તમને મદદ કરવા માટે તેનો
ઉપયોગ નહીં કરું. હું તું ત દેવને અપણા કરીશ.’ ૧૨ તમે
વ્યક્તિને તેના મા કે પિતા માટે એથે વધુ કાઈ કરવાની
મંજૂરી આપતા નથી. ૧૩ તેથી તમે ઉપદેશ આપો છો કે
દેવે જે કહ્યું છે તે મહત્વનું નથી. તમે ધારો છો કે તમે
લોકોને જ ઉપદેશ આપો છો તે નિયમોને અનુસરવું તે
વધારે મહત્વનું છે અને તમે તેના જીવું ધારું કરો છો.”

૧૪ ઈસુએ કરીથી લોકોને તેમની પાસે બોલાવ્યા.
તેણે કહ્યું, “પ્રત્યેક વ્યક્તિએ મને ધ્યાનની સાંભળવો
જોઈએ અને હું જે કહું હું તે સમજાવું જોઈએ. ૧૫ એવી
કોઈ વસ્તુ નથી જે વ્યક્તિ તેના શરીરમાં મૂકે છે જે તેને
અપવિત્ર બનાવે છે. તેના માંથી જે વસ્તુઓ બહાર આવે
છે તેના વડે જ વ્યક્તિ અપવિત્ર બને છે.” ૧૬ તમે લોકો
મારા શરીર ધ્યાનની સાંભળો. તમને લોકોને જો કાન
હોય તો, સાંભળો.

૧૭ પછી ઈસુ તે લોકોને ઘોડીને ઘરમાં ગયો. શિષ્યોએ
ઈસુને આ વાર્તા વિષે પૂજ્યું. ૧૮ ઈસુએ કહ્યું, “તમને
સમજવામાં હજુ મુશ્કેલી છે? તમે ખાતરીપૂર્વક જાણો
છો કે બહારથી વ્યક્તિમાં એવું કશું પ્રવેશતું નથી જે
તેને વટાળી શકે. ૧૯ ખોરાક વ્યક્તિના મગજમાં જતો
નથી. ખોરાક તો પેટમાં જાય છે. પણ તે ખોરાક શરીરની
બહાર નીકળી જાય છે.” (જ્યારે ઈસુએ આ કહ્યું, તેનો
અર્થએ છે કે એવો કોઈ ખોરાક નથી જે લોકોને ખાવા
માટે ખોટો છે.)

૨૦ અને ઈસુએ કહ્યું, “જે વસ્તુઓ વ્યક્તિઓમાંથી
આવે છે તે જ તે વ્યક્તિને વટાળે છે. ૨૧ આ બધી ખરાબ
વસ્તુઓ વ્યક્તિના મનની અંદર શરૂ થાય છે. મનમાં

ખોટા વિચારો, અનૌનિક પાપો, ચોરી, ખૂન, રંધ્યાભિયાર,
સ્વાર્થ, લોકોનું ખરાબ કરવું, વર્થ જીવન, પાપનાં કામો
કરવાં, અદેખાઈ, લોકોની નિંદા કરવી, મિથ્યા દંબ કરવો
અને મૂખાઈભર્યું જીવન. ૨૨ આ બધી હુદ્ધ વસ્તુઓ
વ્યક્તિની અંદરથી આવે છે. આ વસ્તુઓ વ્યક્તિને
વટાળે છે.”

ઈસુની બિનયધૂદી સીને સહાય

૨૩ ઈસુ તે જ્યા ઘોડીને તૂરની આજુબાજુના પ્રદેશમાં
ગયો. ઈસુ ત્યા એક ઘરમાં ગયો. તે ત્યા હતો એમ તે
પદેશના લોકો જાણે એમ ઈસુ ઈચ્છણો નહોતો. પણ
ઈસુ ગુપ્ત રહી શક્યો નહિ. ૨૪ એક સ્ત્રીએ સાંભળ્યું કે
ઈસુ ત્યા હતો. તેની નાની દીકરીની અંદર શેતાનનો
અશુદ્ધ આત્મા હતો. તેથી તે સ્ત્રી ઈસુ પાસે આવીને
તેના ચરણમાં નમી પડી. ૨૫ તે સ્ત્રી યહૂદી ન હતી. તે
ગ્રીક હતી અને સિરિયા પ્રદેશના ફિનીકિયામાં જન્મી
હતી. તે સ્ત્રીએ ઈસુને તેની દીકરીમાંથી ભૂત કાઠવાને
વિનંતી કરી.

૨૬ ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “ધોકરાની રોટલી લઈને
કૂતરાઓન આપવી તે યોગ્ય નથી. પ્રથમ ધોકરાને તેઓ
ઈચ્છે તેટલું બધું બાબા દો.”

૨૭ તે સ્ત્રીએ જવાબ આપ્યો; “તે સાચું છે, પરંતુ. પરંતુ
છોકરાં જે ખોરાકના નાના કકડા મેજ નીચે પડે છે તે
ખાતા નથી. તે કૂતરાઓ ખાઈ જાય છે.”

૨૮ પછી ઈસુએ સ્ત્રીને કહ્યું, “તે એક ઘણો સારો જવાબ
છે, તું જરૂર શકે છો. તે ભૂત તારી દીકરીમાંથી નીકળી
ગયું છે.”

૨૯ તે સ્ત્રી ઘેર ગઈ અને તેની દીકરીને પથારીમાં
પડેલી જાઈ. ભૂત નીકળી ગયું હતું.

ઈસુ બહેરા માણસને સાજો કરે છે

૩૦ પછી ઈસુએ તૂરની આજુબાજુનો પ્રદેશ ઘોડો
અને સિદોન થઈને ગાલીલ સરોવર તરફ ગયો. ઈસુ
દસ ગામોના પ્રદેશમાં થઈને ગયો. ૩૧ જ્યારે તે ત્યા હતો
ત્યારે કેટલાક લોકો એક માણસને તેની પાસે લાવ્યા.
આ માણસ બહેરો હતો અને બોબડો હતો. લોકોએ
ઈસુને તેના હાથ તે માણસ પર મૂકીને તેને સાજો કરવા
વિનંતી કરી. ૩૨ ઈસુ તે માણસને લોકો પાસેથી દૂર તેની
સાથે અડાતમાં દોરી ગયા. પછી ઈસુએ તે માણસના
ગાની અંદર તેની આગળી મૂકી અને થૂઢીને તે માણસની
જીબને સપર્શ કર્યો. ૩૩ ઈસુએ આકાશમાં ઊચે જોયું
અને નિસાસો નાખ્યો. ઈસુએ તે માણસને કહ્યું,

"અફકથા!" (આનો અર્થ, "ગેઘડી જા.") ૩૫જ્યારે ઈસુએ આ કર્યું, ત્યારે તે માણસ સાંભળવા શક્તિમાન બન્યો. તે માણસ તેની જીબનો ઉપયોગ કરવા સમર્થ બન્યો અને રૂપાં બોલવા લાગ્યો.

૩૬ઈસુએ લોકોને આજા કરી કે જે કંઈ બન્યું છે તે વિષે કોઈ વ્યક્તિને કહેવું નહિ. ઈસુએ હમેશા લોકોને આજા કરતા કર્યું કે તેના વિષે બોજા લોકોને કહેવું નહિ. પણ જેમ જેમ તેણે તેના વિષે ન કહેવાની વધુ ને વધુ આજા કરી તેમ લોકો તેના વિષે વધારેને વધારે કહેવા લાગ્યા. ૩૭લોકો ખરેખર નવાઈ પામ્યા. લોકોએ કર્યું, "ઈસુ દરેક વસ્તુ સારી રીતે કરે છે. ઈસુ બહેરા માણસોને સાંભળતાં કરે છે. અને જે લોકો વાત કરી શકતા નથી, તેઓને વાત કરવા શક્તિમાન કરે છે."

ઈસુ ૪,૦૦૦ થી વધારે લોકોને જમાડે છે

બીજુ વખતે ઈસુ સાથે ત્યાં ઘણા લોકો હતા. લોકો પાસે ખાવાનું ન હતું, તેથી ઈસુએ તેના શિષ્યોને તેની પાસે બોલાવ્યા. ઈસુએ કર્યું, "મને આ લોકોની દ્વારા આવે છે. તેઓ મારી સાથે નગ દિવસથી હતા. અને હવે તેઓની પાસે કંઈ ખાવાનું નથી. ઉમારે તેઓને વધે ભૂખ્યા મોકલવા જોઈએ નહિ. જો તેઓ જમ્યા વિના જરૂર તો થરે જતાં તેઓ રસ્તામાં બેહોશ થઈ જરૂર. આ લોકોમાંના કેટલાક તો ખૂબ દૂરથી અહીં આવ્યા છે."

ઈસુના શિષ્યોએ જવાબ આપ્યો, "પરંતુ આપણે કોઈ પણ ગામથી ઘણા દૂર છીએ. આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલી આપણે ક્રાંથી મેળવી શકીએ?"

૪૫છી ઈસુએ તેઓને પૂછ્યું, "તમારી પાસે કેટલી રોટલીઓ લીધી અને દેવની સુતુતિ કરી. ઈસુએ રોટલીના ભાગ કર્યા અને તેના શિષ્યોને તે ટુકડાઓ આપ્યા. ઈસુએ તે શિષ્યોને લોકોને રોટલી આપવા કર્યું. શિષ્યોએ તેનું માન્ય. જે શિષ્યો પાસે થોડી માછલીઓ હતી. ઈસુએ માછલી માટે સુતુતિ કરી અને લોકોને માછલી આપવા શિષ્યોને કર્યું. 'બધા લોકોએ ખાદુ અને તુપન થયા. પછી શિષ્યોએ નહિ ખાધેલા ખોરાકના ટુકડાઓથી સાત ટોપલીઓ ભરી. ૪૬્યાં લગભગ ૪,૦૦૦ પુરુષોએ ખાદુ. તેઓના ખાદી પછી ઈસુએ

તેઓને ઘર જવા માટે કર્યું. ૩૭ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં દલમનૂથાની હદમાં ગયો.

ઈસુની કસોરી કરવાનો ફરોશીઓનો પ્રયત્ન

૩૮ઈસુએ ઈસુ પાસે આવ્યા અને તેને પ્રશ્નો પૂછ્યા. તેઓ ઈસુની પરીક્ષા કરવા ઈચ્છતા હતા. તેથી તઓએ ઈસુને આકાશમાંથી નિશાની માગીને તે દેવ તરફથી આવ્યો હતો તે બતાવવા કર્યું. ૩૯ઈસુએ નિસાસો નાખ્યો. તેણે કર્યું, "તમે લોકો શા માટે નિશાની સાબિતી તરીકે માગો છો? હું તમને સત્ય કર્યું છું. તેના જેવી કોઈ નિશાની તમને આપવામાં આવશે નહિ." ૪૦પછી ઈસુ ફરોશીઓને થોડીને હોડીમાં બેસીને પેલે પાર ગયો.

ઈસુની યદ્દૂઢી આગેવાનો વિરુદ્ધ ચેતવણી

૪૧તે શિષ્યો પાસે હોડીમાં તેઓનો પાસે ફક્ત રોટલીનો એક ટુકડો હતો. તેઓ વધારે રોટલી લાવવાનું ભૂલી ગયા. ૪૨ઈસુએ તેમને ચેતવણી આપી, "સાવધાન રહો! ફરોશીઓના ખમીર અને હેરોટના ખમીરથી સાવધ રહો." ૪૩શિષ્યોએ આના અર્થની ચર્ચા કરી. તેઓએ કર્યું, "તેણે આ કર્યું કારણ કે આપજી પાસે રોટલી નથી."

૪૪ઈસુએ જાણ્યું કે તે શિષ્યો આના વિષે વાતો કરતા હતા. તેથી ઈસુએ તેઓને પૂછ્યું, "શા માટે તમે રોટલી નહિ હોવા વિષે વાત કરો છો? તમે હજુ પણ જોઈ શકતા નથી કે સમજુ શકતા નથી? શું તમે સમજવા શક્તિમાન નથી? ૪૫શું તમારી પાસે જે આખો છે તે આ જોઈ શકતી નથી? શું તમારી પાસે જે ક્રાન છે તે સાંભળી શકતા નથી? યાદ કરો મેં આગાઉ શું કર્યું હતું, જ્યારે આપજી પાસે પૂરતી રોટલી ન હતી. ૪૬મેં પાંચ રોટલીમાંથી ૫,૦૦૦ લોકોને જમાડ્યા હતા. યાદ કરો કે તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓથી તમે કેટલી ટોપલીઓ ભરી હતી?"

૪૭તે શિષ્યોએ ઉત્તર આપ્યો, "અમે બાર ટોપલીઓ ભરી હતી."

૪૮"અને યાદ કરો કે મેં સાત રોટલીમાંથી ૪,૦૦૦ લોકોને જમાડ્યા હતા. યાદ કરો તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓથી તમે કેટલી ટોપલીઓ ભરી હતી?"

૪૯તે શિષ્યોએ ઉત્તર આપ્યો, "અમે સાત ટોપલીઓ ભરી હતી."

૫૦પછી ઈસુએ તેઓને કર્યું, "મે જે કર્યું તે બધું તમે યાદ કરો છો, પણ હજુ તમે સમજુ શકતા નથી?"

ઈસુનું બેથસેદામાં આંધળા માણસને સાજ કરવું
૩૭૧સુ અને તેના શિષ્યો બેથસેદામાં આવ્યા.
કેટલાએક લોકો એક આંધળા માણસને ઈસુને પાસે લાવ્યા.
તેઓએં તે માણસને સ્પર્શ કરવા ઈસુને વિનતી કર્યા.
૩૭૨થી ઈસુને તે આંધળા માણસનો હાથ પકડયો અને
તેને ગામની બહાર દોરી ગયા. પછી ઈસુ તે માણસની
આંખો પર ચૂક્યો. ઈસુને તેના હાથ આંધળા માણસ
પર મૂક્યા અને તેને કહ્યું, "હવે તું જોઈ શકે છો?"

૩૭૩આંધળા માણસે ઊચુ જીયું અને કહ્યું, "હા, હું
લોકોને જોઈ શકું છું. તેઓ આજુભાજુ ચાલતા વૃક્ષાન્ધા દેખાય છે."

૩૭૪કૃષીથી ઈસુને તેનો હાથ આંધળા માણસની આંખો
પર મૂક્યો. પછી તે માણસે તેની આંખો પહોળી કરીને
ખોલી. તેની આંખો સાજુ થઈ ગઈ, અને તે દરેક વસ્તુ
સ્પષ્ટતાપૂર્વક જોઈ શકતો હતો. ૩૭૫ઈસુને તેને ઘેર જવા
કહ્યું. ઈસુને કહ્યું, "ગામમાં જઈશ નહિ."

પિતર કહે છે ઈસુ એ જ પિસ્ત છે

૩૭૬ઈસુ અને તેના શિષ્યો કેસરિયા ફિલિપ્પીનાં
ગામડાઓમાં ગયા. જ્યારે તેઓ મુસાફરી કરતા હતા,
ઈસુને શિષ્યોને પૂછ્યું, "હું કોણ છું, એ વિષે લોકો શું
કહે છે?"

૩૭૭શિષ્યોએ ઉત્તર આપ્યો, "કેટલાક લોકો તને યોહાન
બાપ્તિસ્ટ કહે છે. બીજા કેટલાક લોકો તને એલિયા કહે
છે. અને બીજા કેટલાક લોકો કહે છે કે તું પ્રબોધકોમાંનો
એક છો."

૩૭૮પછી ઈસુને પૂછ્યું, "હું કોણ છું એ વિષે તમે શું
કહો છો?"

પિતર ઉત્તર આપ્યો, "તું તો પિસ્ત છો."

૩૭૯ઈસુને તેના શિષ્યાને કડકાઈથી કહ્યું: "હું કોણ
છું તે જોઈનું કહેવું નહિ."

૩૮૦પછી ઈસુને તમને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. કે
માણસના પુત્રો ઘણું બધું સહન કરવું જોઈએ. ઈસુને
બોધ આપ્યો કે માણસના પુત્ર, વડીલ યહુદી આગોવાનો
મુખ્ય યાજકો અને શાસીઓ દ્વારા નાપસંદ થશે. ઈસુને
બોધ આપ્યો કે માણસના પુત્રને મારી નંભાશે અને
પછી મૃત્યુમાંથી નજી દિવસો પછી તે ઊભો થશે.
૩૮૧ઈસુને તેઓને દરેક જે બનવાનું હતું તે કહ્યું. તેણે
કશુંય ગુપ્ત રાખ્યું નહિ. પિતર ઈસુને બાજુમાં લઈ
ગયો અને આ વાતો કહેવા માટે તેને ઠપકો આપવા
લાગ્યો. ૩૮૨પછી ઈસુ પાછો ફર્યો અને તેના શિષ્યો તરફ
જોયું. પછી તેણે પિતરને ઠપકો આપ્યો. ઈસુને પિતરને

કહ્યું, "શેતાન! મારી પાસેથી દૂર જા, તું દેવની વાતોની
પરવા કરતો નથી. તું ફક્ત લોકો જેને મહત્વ આપે છે
તેની જ કાળજી રાખે છે."

૩૮૩પછી ઈસુને લોકોને તેની પાસે બોલાવ્યા. તેના
શિષ્યો પણ ત્યાં હતા. પછી ઈસુને કહ્યું, "જો ક્રીએ
વ્યક્તિ મને અનુસરવા હીચે તો તેણે જે વસ્તુઓ તે
હીચે છે તેની "ના" કહેવી જોઈએ. તે વ્યક્તિએ વધસત્તનભ
(પીડા) સ્વીકારવા જોઈએ જે તેને આપવામાં આવેલ
છે, અને તેણે મને અનુસરવું જોઈએ. ૩૮૪ વ્યક્તિ તેનું
જીવન બચાવવા હીચે છે તે ગુમાવશે. અને પ્રત્યેક
વ્યક્તિ જ મારા માટે અને સુવાતો માટે તેનું જીવન
આપે છે, તે હમેશને માટે તેનું જીવન બચાવશે. ૩૮૫ જો
ક્રીએ વ્યક્તિ આંખું જગત જીતે છે પણ તેનું જીવન
ગુમાવે છે તો તેને કઈ રીતે લાભદારી છે? ૩૮૬ વ્યક્તિ
કૃષીથી તેના જીવ ખરીદવા કદાપિ કશું પૂરતું આપી
શકતો નથી. ૩૮૭ લોકો હમણા જીવે છે; તેઓ પાપી
અને દુષ્પ સમયમાં જીવે છે. જે ક્રીએ મારે લીધ તથા
મારી વાતોને લીધ શરમાશે તેને લીધ હું જ્યારે મારા
પિતાના મહિમામાં પવિત્ર દૂસો સાથે આવીશ, ત્યારે તે
વ્યક્તિથી શરમાઈશ."

૩૮૮પછી ઈસુને કહ્યું, "હું તમને સત્ય કહું છું
કે, તમારામાંના કેટલાએક લોકો અહીં ઊભા છે
તેઓ તેમના મૃત્યુ પહેલા દેવના રાજ્યને આવતું જોશે.
દેવનું રાજ્ય પરાક્રમ સાથે આવશે."

ઈસુ મૂસા અને એલિયા સાથે

૩૮૯ દિવસો પછી ઈસુ પિતર, યાદૂબ તથા યોહાનને
લઈને એક ઊચા પર્વત પર ગયો. તેઓ બધા ત્યાં એકલા
હતા. જ્યારે શિષ્યોની નજીર સમક્ષ તેનું રૂપાંતર થયું,
ત્યારે ઈસુનાં કપડાં સર્કદ ચમકતાં થયા. કપડાં બીજું
વ્યક્તિ બનાવી શકે તેના કરતાં વધારે ઊજાણાં હતાં.
૩૯પછી ત્યાં બે માણસો આવ્યા અને ઈસુ સાથે વાતો
કરવા લાગ્યા. તે માણસો મૂસા અને એલિયા હતા.

૩૯૦પિતર ઈસુને કહ્યું, "ઉપદેશક, તે સારું છે કે આપણે
અહીં છીએ. અહીં આપણે ત્રણ માંડવા બાધીએ. એક
તારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે."
૩૯૧પિતરે શું કહેવું તે આશતો ન હતો. કારણ કે તે અને
બીજા બંશિયો બહુ બીધા હતા.

૩૯૨પછી એક વાદળ આવ્યું અને તેઓ પર છાયા કર્યું.
વાદળમાંથી એક અવાજ આવ્યો અને કહ્યું, "આ (ઈસુ)
મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. તેને તાબે થાઓ!"

૮૫થી પિતર, યાકૂબ, અને યોહાને જોયું, પણ તેઓ ફક્ત ત્યાં ઈસુને તેઓની સાથે એકલો જોયો.

ઈસુ અન તેના શિષ્યો પર્વત પરથી નીચે પાછા ઉત્તરતા હતા ત્યારે ઈસુને શિષ્યોને આશા કરી. “તમે પર્વત પર જે વસ્તુઓ જોઈ છો તે વિષે કોઈ વ્યક્તિને કહેશો નહિ. માણસનો પુત્ર મૂખેલામાંથી સજીવન ન થાય ત્યાં સુધી રાહ જુયો. પછી તમે જે જોયું છો તે લોકોને કહી શકો છો.”

૧૦થી શિષ્યોએ ઈસુની આશા માની, અને તેઓઓ જે જોયું હતું તે વિષે કશું કશું નહિ. પણ તેઓઓ મૂખેલામાંથી સજીવન થવા વિષે ઈસુ શું સમજે છે તેની ચર્ચા કરી. “શિષ્યોએ ઈસુને પૂછ્યું, ‘પ્રથમ એલિયાએ આવવું જોઈએ એવું શાસીઓ શા માટે કહે છું?’”

ઈસુએ ઉત્તર આપ્યો, “એલિયાએ પ્રથમ આવવું જોઈએ એ કહેવા માટે તેઓ સાચા છે. એલિયા બધી વસ્તુઓ જે રીત હોવી જોઈએ તેવી બનાવે છે. પણ શાસ્ત અંતું શા માટે કહે છે કે માણસનો પુત્ર ધાર્યું સહન કરશે અને લોકો તેનો અસ્વાનીકર કરશે? ૧૩હું કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે, અને તેના વિષે શાસ્તમાં કહેલું છે તે પ્રમાણે લોકોએ જેમ ચાલ્યું તેમ તેન કર્યું.”

ઈસુનું બિમાર છોકરાને સાજા કરવું

૧૪પછી ઈસુ પિતર, યાકૂબ અને યોહાન બીજા શિષ્યો પાસે ગયા. તેઓએ ઘણા લોકોને તેઓની આજુભાજુ જોયા. શાસીઓ શિષ્યો સાથે દલીલો કરતા હતા. ૧૫જ્યારે લોકોએ ઈસુને જોયો, તેઓ વધારે અયરત પામ્યા. તેઓ તેને આવકારવા તેની પાસે દોડી ગયા.

૧૬ઈસુએ પૂછ્યું, “તમે શાસીઓ સાથે શાના વિષે દલીલો કરો છો?”

૧૭ટોળામાંથી એક માણસે જવાબ આપ્યો, “ઉપદેશક, હું મારા પુત્રને તારી પાસે લાવ્યો છું. મારા પુત્રમાં શેનાનાં આત્મા તેની અંદર છે. આ અશુદ્ધ આત્મા મારા પુત્રને વાતો કરતા અટકાવે છે. ૧૮અશુદ્ધ આત્મા મારા પુત્ર પર હુમલો કરે છે અને તેને જમીન પર ફેંક છે. મારો પુત્ર તેના મુખમાંથી ફીઝ કરે છે. તેના દાંત કચકચાવે છે. અને તે તવાંનો જાય છે. મેં તારા શિષ્યોને અશુદ્ધ આત્માને બહાર કાટવા માટે કશું, પણ તેઓ કાઢી શકાના નહિ.”

૧૯ઈસુએ કશું, “તમે લોકો વિશ્વાસ કરતા નથી! ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? છોકરાને મારી પાસે લાવો!”

૨૦તેથી શિષ્યો તે છોકરાને ઈસુ પાસે લાવ્યા. જ્યારે દુષ્ટ આત્માએ ઈસુને જોયો, તે અશુદ્ધ આત્માએ છોકરા પર હુમલો કર્યો. તે છોકરો નીચે પડ્યો અને જમીન પર આંદોટાં હતો. તેના મુખમાંથી ફીઝ નીકળતું હતું.

૨૧ઈસુએ છોકરાના પિતાને કશું, “કટલા વાંબા સમયથી આ છોકરાને આવું થાય છે?”

પિતાએ જવાબ આપ્યો, “તે ઘણો નાનો હતો ત્યારથી. ૨૨તે અશુદ્ધ આત્માએ તેને ઘણી વખત મારી નાખવા માટે અગ્રિમાં તથા પાણીમાં નાખ્યો હતો. જો તું તેને માટે કશું કરી શકે તો કૃપા કરીને અમારા પર દયા કરી અને અમને મદદ કર.”

૨૩ઈસુએ પિતાને કશું, “તે કશું કે, ‘શક્ય હોય તો મદદ કર.’ જે વ્યક્તિ વિશ્વાસ કરે છે તેના માટે બધી વસ્તુઓ શક્ય છે.”

૨૪પિતા ઘણો ઉત્તેજિત થયો. તેણે કશું, “હું જરૂર વિશ્વાસ કરું છું. મને વધારે વિશ્વાસી બનવામાં મદદ કર!” ૨૫ઈસુએ જોયું કે બધા જે લોકો ત્યાં શું બની રહ્યું છે તે લોકા માટે દોડાના હતા તેથી ઈસુએ અશુદ્ધ આત્માને કશું “ઓ અશુદ્ધ આત્મા, તું આ છોકરાને બહેરો બનાવે છે અને તેને વાત કરતાં અટકાવે છો-હું તને આ છોકરામાંથી બહાર આવવાને અને કદાપિ તેનામાં નહિ પ્રવેશવા હુકમ કરું છું!”

૨૬તે અશુદ્ધ આત્માએ ચીસ પાડી. તે આત્માએ તે છોકરાને ફીથી જમીન પર પાડ્યો. અને પછી તે અશુદ્ધ આત્મા બહાર નીકળી ગયો. તે છોકરો મરી ગયો હતો અનું દેખાયું. ઘણા લોકોએ કશું, “તે મૃત્યુ પામ્યો છે!”

૨૭પરંતુ ઈસુએ તે છોકરાનો હથ પકડ્યો અને તેને ઊભો થવામાં મદદ કરી.

૨૮ ઈસુ ધરમાં ગયો. ત્યાં તેની સાથે તેના શિષ્યો એકલા હતું. તેઓએ તેને પૂછ્યું “અમે શા માટે અશુદ્ધ આત્માને બહાર કાઢી શકાના નહિ?”

૨૯ઈસુએ ઉત્તર આપ્યો, “આ પ્રકારના આત્માને ફક્ત પ્રાર્થનાના ઉપયોગ દ્વારા જ બહાર કાઢી શકાય છે.”

ઈસુનું તેના મૃત્યુ વિષે કહેવું

૩૦પછી ઈસુ અને તેના શિષ્યોએ તે જગ્યા છાડી. તેઓ ગાલીલમાં થઈને ગયા. ઈસુ ક્રાં હતો તે લોકો જીથે એમ ઈચ્છાનો નહોતો. અઈસુ તેના શિષ્યોને એકલાન ઉપદેશ આપવા ઈચ્છાનો હતો. ઈસુએ તેઓને કશું, “માણસનો પુત્ર લોકોને સોપવામાં આવશે. તેઓ તેને મારી નાખશે. મારી નાખશા પછી, નશ દિવસ પછી તે મૃત્યુમાંથી સજીવન થશે.” અપરંતુ ઈસુ જે

કહેવા ભાગાં હતો તે શિષ્યો સમજ્યા નહિ, અને તેઓ તેણે શું અર્થ કર્યા છે એ પૂછતાં ડરતા હતા.

ઈસુ કહે છે કે સૌથી મહાન ક્રીષ્ણ છે

ઉર્ધ્વસુ અને તેના શિષ્યો કફર-નહૂમ ગયા. તેઓ એક ઘરમાં ગયા. પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “મેં આજે રસ્તા પર તમને દ્વિલો કરતાં સાંભળ્યા. તમે શાના વિષે દ્વિલો કરતા હતા?” ઉપરંતુ શિષ્યો શાંત રહ્યાં હત્યા કે રસ્તામાં તેઓ અંદર અંદર સૌથી મોટો ક્રીષ્ણ હતો તે અંગેનો વિવાદ કરતા હતા. ઉર્ધ્વસુ નીચે બંધી અને બાર પ્રેરિતાને તેની પાસે બોલાયા. ઈસુએ કહ્યું, “જો કોઈ વ્યક્તિની ઈચ્છા સૌથી વધારે મહત્વના વ્યક્તિ બનવાની હોય તો પછી તેણે બીજા દરેક લોકોને તેના કરતા વધારે મહત્વના ગણવા જોઈએ. તે વ્યક્તિએ બીજા બધા લોકોની સેવા કરવી જોઈએ.”

ઉર્ધ્વશી ઈસુએ એક નાનું બાળક લીધું. ઈસુએ બાળકને શિષ્યો આગળ ઊભુ રાખ્યું. ઈસુએ તે બાળકને તેના ખોળામાં લીધું અને કહ્યું, “જો કોઈ વ્યક્તિ મને પણ સ્વીકાર કરશે તો તે વ્યક્તિ મને પણ સ્વીકારે છે. અને જો વ્યક્તિ મને સ્વીકાર છે તો પછી તે વ્યક્તિ મને મોકલનારને (દેવને) પણ સ્વીકારે છે.”

જે વ્યક્તિત્વ આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે

ઉર્ધ્વશી યોધાને કહ્યું, “ઉપરેશક, અમે તારા નામનો ઉપયોગ કરીને એક વ્યક્તિને ભૂતને બહાર કાઢતાં દીશો. તે આપણા જૂથનો ન હતો. તેથી અમે તેને તે બંધ કરવા કહ્યું.”

ઉર્ધ્વસુએ કહ્યું, “તેને રોકશો નહિ, જે કોઈ વ્યક્તિત્વ પરાક્રમ કરવા મારા નામનો ઉપયોગ કરે છે તે તે મારા વિષે ખરાબ કહેશ નહિ. ૪૦જે વ્યક્તિત્વ આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે. ઔર તને સાચ કહુ છું, જે કોઈ વ્યક્તિત્વ તને પીવાનું પાણી આપીને મદદ કરે છે કારણ કે તું જિસ્તનો શિષ્ય છે, તો તે વ્યક્તિત્વ ખરેખર તેનો બદલો પ્રાણ કરશે.”

૪૨“જો આ નાના બાળકોમાંના એક મારામાં વિશ્વાસ કરે અને બીજુ એક વ્યક્તિત્વ તે બાળકને પાપ કરવા કારણરૂપ બને, તો તે વ્યક્તિત્વ માટે તે ધારું ખરાબ હશે. તે વ્યક્તિત્વ તેના ગણે ઘંઠીનું પડ બાધીને દરિયામાં જીસે દુંગી જાય તે વધારે સારું છે. ૪૩જો તારો હાથ તને પાપ કરાવે તો તે કાપી નાખ. તારા માટે તારા શરીરનો ભાગ ગુમાવવો એ વધારે સારું છે. પણ જીવન તો સદાય રહે, બે પગો સાથે નરકમાં ફક્તવામાં આવે તેના કરતાં તે વધારે સારું છે. ૪૪* ૪જો તારી આખ તને પાપ કરાવે તો તને બહાર શાદી નાખ, તારી પાસે ફક્ત એક આખ હાલી વધારે સારું છે. પણ જીવન તો સદાય રહે. બે આંખો સાથે નરકમાં ફક્તવામાં આવે તેના કરતાં તે એક આખ સાથે દેવના રાખમાં પવેશ કરવો તે વધારે સારું છે. ૪૫નરકમાં લોકોને જે જંતુઓ ખાય છે તે કદાપિ મરતા નથી. નરકમાં અન્ધી કદાપિ હોલવાતો નથી. ૪૬પત્યેક વ્યક્તિત્વ અન્ધી વડે શિક્ષા પામશે.”

૫૦મીઠું એ સારું છે. પરંતુ મીઠું તેનો ભારો સ્વાદ ગુમાવે પછી તમે તેણી ફરીથી ખારું બનાવી શકતા નથી. તરીકે ભલાઈથી પૂર્ણ બનો અને એકબીજા સાથે શાંતિ રાખો.”

ઈસુનો કારગતીનો ઉપદેશ

પછી ઈસુએ તે જગ્યા છોડી. તે યર્દન નહીને ૧૦ પેલે પાર યહૂદીયા પ્રદેશમાં ગયો. ફરીથી ઘણા લોકો તેની પાસે આવ્યા. ઈસુ હમેશા કરતો હતો, તેવી રીતે લોકોને ઉપદેશ આપ્યો.

ઉર્ધ્વલાક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા. તેઓએ ઈસુ કઈક ખોટુ કહે તે માટે પ્રયત્નો કર્યા. તેઓએ ઈસુને પૂછ્યું, “પોતાની પત્નીને કારગતી આપવી તે માણસ માટે યોગ્ય છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “મૂસાએ તમને શું કરવા હુકમ કર્યો હતો?”

તે ફરોશીઓએ કહ્યું, “મૂસાએ કારગતીનું પ્રમાણપત્ર લાયા. પછી તેની પત્નીથી કારગતી લવાની માણસને પરવાનગી આપી છે.”

ઈસુએ કહ્યું, “મૂસાએ તે આજા તમારા માટે લખી છે કારણ કે તમે દેવના ઉપદેશને સ્વીકારવાની ના પાડી. ૪૮પરંતુ જાય દેવ દુનિયા બનાવી, ‘તેણે તેઓમાં નર અને નારીનું સર્જન કર્યુ.’ ૪૯તેથી માણસ તેના માતાપિતાને છોડીને તેની પત્ની સાથે જોડાશે. અને

કલમ ૪૪ માર્કની ઉર્ધ્વલાક ગ્રીક નકલોમાં કલમ ૪૪ જોડવામાં આવી છે, જે કલમ ૪૮ ને મળતી આવે છે.

કલમ ૪૬ માર્કની ઉર્ધ્વલાક ગ્રીક નકલોમાં કલમ ૪૬ જોડવામાં આવી છે, જે કલમ ૪૮ ને મળતી આવે છે.

બે જગ્યા એક બનશે.' તથી તેઓ બે નથી પણ એક છે.
દેવે તે બેને સાથે જોક્યા છે. તથી કોઈ વ્યક્તિએ તેઓને
છૂટ નહિ પાડવા જોઈએ."

"પાછળથી તે શિષ્યો અને ઈચ્છુ વરમાં હતા. તે
શિષ્યોએ ફરીથી ઈચ્છુને ફારગતીના પ્રશ્ન વિષે પૂછ્યું.
ઈચ્છુએ ઉત્તર આપ્યો, "કોઈ પણ વ્યક્તિ જે તની
પત્નીન ફારગતી આપે છે અને બીજી સીને પરણે છે.
તે તની પત્ની વિરુદ્ધ પાપમાં દોપિત છે. તે વ્યબિચારના
પાપ માટે ગુનેગાર છે. રૂઘને જે સી પોતાના પતિને
ફારગતી આપે છે અને બીજા પુરુષને પરણે છે ત્યારે તે
પણ વ્યબિચાર માટે દોપિત છે."

ઈચ્છુનો બાળકોનો સ્વીકાર

૧૭લોકો તેમનાં નાનાં બાળકોન ઈચ્છુ પાસે લાવ્યાં.
તથી તેઓને સ્પર્શી શકે. પરંતુ શિષ્યોએ લોકોને તેમના
બાળકોને ઈચ્છુ પાસે લાવતા અટકાવ્યા. ૧૮ઈચ્છુએ શુ
બંધું તે જોયું. તેના શિષ્યોનું બાળકોને નહિ આવવા
માટેનું કહેવું તેને ગંધ્યું નહિ. ઈચ્છુએ તેઓને કહ્યું "નાનાં
બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ.
કારણ કે દેવનું રાજ્ય અને લોકોનું છે જેઓ આ નાનાં
બાળકો જેવાં છે. પ્રહૃતું તમને સાચું કહ્યું છું, તમારે દેવના
રાજ્યનો સ્વીકાર, એક નાનું બાળક વસ્તુઓ સ્વીકારે છે
તેવી રીતે કરવો જોઈએ. નહિ તો તમે કદાપિ તેમાં
પ્રવેશ કરશો જ નહિ." ૧૯પછી ઈચ્છુએ બાળકોને તેના
બાધમાં લીધા. ઈચ્છુએ તેઓના પર હાથ મૂકી તેઓને
આશીર્વાદ દીધો.

એક ધનવાનની ઈચ્છુને અનુસરવાની ના

૨૦ઈચ્છુએ વિદાય થવાની શરૂઆત કરી. પરંતુ એક
માણસ દોડણો આવ્યો અને ઈચ્છુની આગળ તેનાં ઘૂંઠણે
પડ્યો, તે માણસે પૂછ્યું "ઉત્તમ ઉપદેશક, અનંતજીવન
મેળવતા મારે શુ કરવું જોઈએ?"

૨૧ઈચ્છુએ ઉત્તર આપ્યો; "તું મને ઉત્તમ શા માટે કહે
છે? કોઈ વ્યક્તિ ઉત્તમ નથી. ફક્ત દેવ જ ઉત્તમ છે.
૨૨પણ હું તારા પ્રશ્નનો ઉત્તર આપીશ. તું આજીઓનો
આણે છે: 'તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ, તારે
વ્યબિચારનું પાપ કરવું જોઈએ નહિ, તારે ચોરી કરવી
જોઈએ નહિ, તારે તારા માબાપને માન આપવું
જોઈએ.... *'

૨૩તે માણસે કહ્યું, "ઉપદેશક, હું બાળક હતો ત્યારથી
આ બધી આજીઓનું પાલન કરું છું."

૨૪ઈચ્છુએ તે માણસ સામે જોયું. ઈચ્છુને તેના પર હેત
આલ્યુ. ઈચ્છુએ કહ્યું "તું એક વાત સબધી અધૂરો છે.
જો અને તારી પાસે જે બધું છે તે વેચી નાખ. પેસા
ગરીબ લોકોને આપ. તને આકાશમાં તેનો બદલો મળશે.
પછી આવ અને મને અનુસર."

૨૫ઈચ્છુને આમ કહેતા સાંભળીને તે માણસનો ચહેરો
ફિક્કો પડી ગયો. અને તે વિદ્યાય થયો. તે માણસ દુઃખી
હતો કારણ કે તે ઘણો પેસાદાર હતો અને તેના પેસા
રખવા ઈચ્છાતો હતો.

૨૬પછી ઈચ્છુએ તેના શિષ્યો તરફ જોયું અને તેઓને
કહ્યું, "ધનવાન વ્યક્તિઓ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું
ધાર્યું મુશ્કેલ હશ!"

૨૭ઈચ્છુએ જે કહ્યું તથી શિષ્યો આશ્રયચક્તિ થયા.
પણ ઈચ્છુએ ફરીથી કહ્યું, "મારાં બાળકો, દેવના રાજ્યમાં
પ્રવેશવું તે ધાર્યું કઠિન છું! ૨૮પછે પેસાદાર માણસો માટે
દેવના રાજ્યમાં પ્રવેશવું તે ધાર્યું મુશ્કેલ બનશે. સેયના
નાકામાંથી પસાર થવું જોટના માટે વધારે સહેલું બનશે!"

૨૯તે શિષ્યો વધારે નવાઈ પામ્યા હતા અને
એકબીજાને કહ્યું "તો કોણ તારણ પામી શકે?"

૩૦ઈચ્છુએ શિષ્યો તરફ જોયું અને કહ્યું, "આ કહીક
એવું છે જે લોકો તેમની જીતે કરી શકે નહિ, તે દેવ
પાસથી આવવું જોઈએ. દેવ બધી વસ્તુઓ કરી શકે
છે." ૩૧પછી ઈચ્છુને કહ્યું, "અમે તને અનુસરવા બધું
જ ધોડી દીધું!"

૩૨ઈચ્છુએ કહ્યું, "હું તમને સત્ય કહું છું, પ્રત્યેક વ્યક્તિ
જોણ તેનું ધર, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો
અથવા ભેતરોને મારી સુવાર્તા માટે છોડા છે, ૩૩તેઓએ
જટલું છોડ્યું છે તેના કરતાં સોગણું વધાં મેળવશે.
અહીં આ દુનિયામાં તે વ્યક્તિ વધારે વધો, ભાઈઓ,
બહેનો, મા, પિતા, બાળકો અથવા ભેતરો મેળવશે અને
તે વસ્તુઓ સાથે તે વ્યક્તિની સત્તાવણી થશે. પણ
આવનાર દુનિયામાં તેને બદલો મળશે. તે બદલો
અનંતજીવન છે. અથવા લોકો જેની પાસે હાલમાં
ગીયામાં ગીયો જગ્યા છે, તેમની પાસે ભવિષ્યમાં
નીચામાં નીચી જગ્યા હશે. અને જે લોકો પાસે હાલમાં
નીચામાં નીચી જગ્યા છે તેઓ ભવિષ્યમાં ગીયામાં
ગીયો જગ્યા મેળવશે."

ઈચ્છુ ફરીથી તેના મૃત્યુ વિષે કહે છે
ઉદ્દીપુનિ અને તેની સાથેના લોકો યરશાલેમ જતા

હતા. ઈસુ લોકોને દોરતો હતો. ઈસુના શિષ્યોને આશ્રયચકિત થઈ ગયા. પણ પેલા લોકો જે તેની પાછળ આવતા હતા તેઓ બીતાં હતા. ઈસુએ ફરીથી ભાર પ્રેરિતોને વેગા કર્યા. અને તેઓની સાથે એકલા વાત કરી. ઈસુએ યરુશાલેમમાં શું થશે તે તેઓને કહ્યું. ઉઈસુએ કહ્યું, “આપણે યરુશાલેમ તરફ જઈએ છીએ. માણસના પુત્રને મુખ્ય યાજકો અને શાસીઓના હાથમાં સોંપવામાં આવશ. યાજકો અને શાસીઓ કહેશ કે માણસના પુત્ર મરવું ઓઈએ. તેઓ બિનયહૂટી લોકોને માણસનો પુત્ર સાંપણે. ઉતે લોકો તેની મશકરી કરશે અને તેના પર થુંકશે, તેઓ તેને ચાબુકથી મારશે અને તેને મારી નામશે. પરંતુ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે પાછો ઊદ્ઘાસે.”

યાકૂબ અને યોહાનની માગણી

ઉપછી જબડીનો દીકરો યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવે છે. તેઓએ કહ્યું, “ઉપદેશક, અમે તને અમારા મારે કણુક કરવાનું કહેવાની ઈચ્છા રાખીએ છીએ.”

ઉઈસુએ પૂછ્યું, “તમે મારી પાસે શું કરાવવા ઈચ્છા છો?”

ઉપુત્રાએ ઉત્તર આપ્યો, “તું તારા મહિમામાં અમારામાંના એકને તારી જમજી બાજુ બસવા દે અને એકને તારી ડાબી બાજુ બેસવા દે.”

ઉઈસુએ કહ્યું, “તમે જે મારો છો તે તમે સમજુ શકતા નથી. મારે જે પીડા સહન કરવાની છે તેવી તમે સ્વીકારી શકશો? અને જે બાનિસ્મા હું લઉ છું તે બાનિસ્મા તમે લઈ શકશો?”

ઉપુત્રાએ ઉત્તર આપ્યો, “હા અમે કરી શકીશું.” ઈસુએ પુછોને કહ્યું, “હું જે સહન કરીશ તે રીતે તમારે સહન કરવું પડશે. હું જે રીતે બાનિસ્મા પામીશ તેવી જ રીતે તમારું બાનિસ્મા થશ. ૪૦પણ મારી જમજી કે ડાબી બાજુથી બસવાનો અવિકાર આપનાર વ્યક્તિન હું નથી. ત્યા કેટલાએક લોકો છે તેઓને પેલી જગ્યાઓ મળશે. પેલી જગ્યાઓ તેમના મારે તૈયાર કરવામાં આવી છે.”

રાબીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું. તેઓ યાકૂબ અને યોહાન પર ગુસ્સે થયા. ઉઈસુએ બધા શિષ્યોને સાથે બોલાવ્યો. ઈસુએ કહ્યું, “બિનયહૂટી લોકો પાસે માણસો છે તાં શાસકો કહેવાય છે. તું આંશે છે કે પેલા શાસકો પર તેમનું ઘડીપણું બતાવવા ઈચ્છે છે અને તેમના આગેવાનો લોકો પર તેઓની બધી સત્તાનો ઉપયોગ કરવા ઈચ્છે છે. ૪૧પણ તમારી સાથે તે રીતે ન

થવું ઓઈએ. તમારામાંથી કોઈ મહાન થવા ઈચ્છતું હોય તો પછી તેણે સેવકની જેમ તમારી સેવા કરવી ઓઈએ. ૪૨જો તમારામાંથી કોઈ એક સૌથી વધારે મહત્વનો થવા ઈચ્છે તો પછી તેણે તમારા બધાની એક દાસની જેમ સેવા કરવી. ૪૩તે જ રીતે, માણસનો પુત્ર બીજા લોકો પાસે તેની સેવા કરાવવા આવ્યો નથી. પરંતુ માણસનો પુત્ર બીજા લોકોની સેવા કરવા માટે આવ્યો છે. માણસનો પુત્ર ઘણા લોકોને બચાવવા તેનું જીવન સમર્પિત કરવા આવ્યો છે.”

એક આધુના માણસને ઈસુનું સાજ કરવું

૪૪એ તેઓ યરેખોના ગામમાં આવ્યા. ઈસુ તેના શિષ્યો અને બીજા ઘણા લોકો સાથે તે ગામની વિદ્યાય લેતા હતા. બર્તમાય નામનો એક આંધળો માણસ (તિમાયનો પુત્ર) રસ્તાની બાજુમાં બઢો હતો. આ માણસ હુમેશા પૈસાની ભીખ માંગતો હતો. ૪૫આધુના માણસે સાંભળ્યું કે નાજરેથનો ઈસુ બાજુમાંથી પસાર થતો હતો. તે આંધળા માણસે ભૂમ પાડી, “ઈસુ, દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”

૪૬ઘણા લોકોએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ

તેને નહિ બોલવા કહ્યું. પરંતુ આંધળો માણસ વધારે ને વધારે ભૂમો પાડવા લાગ્યો. “દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”

૪૭ઈસુ ઊભો રંધો અને કહ્યું, “તે માણસને અહીં આવવા કહો.”

તેથી તેઓએ આંધળા માણસને બોલાવ્યો. તેઓએ કહ્યું, “હિમત રાખ! ઊભો થા! ઈસુ તેને બોલાવે છે.”

૪૮આંધળો માણસ જડપથી ઊભો થયા. તેણે તેનો ડગલો

ત્યા મૂક્યો અને ઈસુ તરફ ગયો.

૪૯ઈસુએ માણસને પૂછ્યું, “મારી પાસે તું શું કરાવવાની ઈચ્છા રાખે છો?”

આંધળો માણસ બોલ્યો, “ઉપદેશક, મારી ઈચ્છા કરી દેખતા થવાની છે.”

૫૦ઈસુએ કહ્યું, “જા, તું તારા વિશ્વાસને કરવો સાજો થઈ ગયો છે.” પછી તે માણસ ફરીથી દેખતો થયો. તે રસ્તામાં ઈસુને અનુસર્યો.

ઈસુનો રાજની જેમ યરુશાલેમમાં પ્રવેશ

૫૧ ઈસુ અન તેના શિષ્યો યરુશાલેમની નજીક

આવતા હતા. તેઓ જેતુનના પહાડ આગળ બેથફળે તથા બેથનિયાના શહેરો પાસે આવ્યા. ત્યા ઈસુએ તેના બે શિષ્યોન આગળ મોકલ્યા. ઈસુએ

શિષ્યોને કહ્યું, "તમે જે ગામ જુઓ છો તે ગામમાં જાઓ. જ્યારે તમે ત્યાં પ્રવેશ કરશો ત્યારે, તમે એક ગંધેડાના વઠેરાને ત્યાં બાધેલો જોશો. આ વઠેરા પર કોઈએ કદી સવારી કરી નથી, તે વઠેરાને છોડીને તેને અહીં મારી પાસે લાવ. તેણે કોઈ વ્યક્તિ તને પૂછે કે તુ તે વઠેરાને શા માટે લઈ જય છે, તો તે વ્યક્તિને કહેજ, 'માલિકને આ વઠેરાની જરૂર છે. તે જલ્દીથી તેને પાણો મોકલશે.'"

તે શિષ્યો ગામમાં ગયા. તેઓએ એક ઘરના દરવાજા નજીક શેરીમાં એક વઠેરાને બાધેલો જોશો. તે શિષ્યોએ તે વઠેરાને છોડ્યો. પ્રેટલાક લોકો ત્યાં ઊભા હતા અને તેઓએ આ જોયું, તે લોકોએ પૂછ્યું; "તમે શુ કરો છો? તમે તે વઠેરાને શા માટે છોડો છો?" ઈસુએ શિષ્યોને જે જવાબ આપવા કહેલું તે રીતે શિષ્યોએ જવાબ આપ્યો. લોકોએ શિષ્યોને વઠેરું લેવા દીધું. શિષ્યો ઈસુ પાસે વઠેરો લાવ્યા. શિષ્યોએ તેમના લૂગડાં વઠેરા પર મૂશ્યાં. અને ઈસુ તેના પર બેઠો. વધા લોકોએ તેમના ડગલા ઈસુ માટે રસ્તા પર પાર્થર્યાં. બીજા લોકોએ ખેતરમાંથી ડાળીઓ કાપી અને રસ્તા પર ડાળીઓ પાથરી.

લેટલાક લોકો ઈસુની આગળ આગળ ચાલતા હતા. બીજા લોકો તેની પાછળ ચાલતા હતા. બધા લોકોએ બૂમ પાડી,

"તેની સુત્તિ કરો!" 'આવકાર! પ્રભુના નામે જે એક આવે છે તે દેવનો આશીર્વાદિત છે!'

ગીતશાસ ૧૧૮:૨૫, ૨૬

૧૦ આપણા પિતા દાઉદના રાજ્યને દેવના આશીર્વાદ છે. તે રાજ્ય આવે છે! પરમ ઊચામાં દેવની સુત્તિ કરો!"

ઈસુ યરુશાલેમમાં દ્યાખલ થયો અને મંદિરમાં ગયો. ઈસુએ મંદિરમાં દરેક વસ્તુઓ તરફ જોયું, પણ સાંજ પડી ગઈ હતી, તેથી ઈસુ બાર પ્રેરિતો સાથે બેથનિયા ગયો.

અભીજ દિવસે, જેવું તેઓએ બેથનિયા છોડ્યું, ઈસુ ભૂખ્યો થયો હતો. તેણું દૂર એક અંજીરીનું જાડ જેને પાંડડા આવ્યાં હતાં તે જોયું. તેથી ઈસુ તે જાડ પાસે ગયો કે કદાચ તેને તે પરથી કંઈ મળો, પણ ઈસુએ તે જાડ પર કોઈ અંજીર જોયા નહિ. ત્યાં ફક્ત પાંડડાઓ હતાં. કેમ કે અંજીરોની ઋતુ ન હતી. અંતે ઈસુએ તે જાડને કહ્યું, "લોકો તારા પરથી ફરી કદી ફળ ખાશે નહિ." ઈસુના શિષ્યોએ તેને આ કહેતા સાંભળ્યું.

ઈસુનું મંદિરમાં જવું

ઈસુ અને તેના શિષ્યો યરુશાલેમમાં ગયા. તે મંદિરમાં ગયો. ઈસુએ ત્યાં જે લોકો વસ્તુઓ વેચતા હતા અને ખરીદતા હતા તેઓને બહાર કાઢવાની શરૂઆત કરી. ઈસુએ નાશાવટીઓની મેજો તથા કબૂતર વેચનારાઓની પાટલીઓ ઊંઘી વાળી. ઈસુએ મંદિરમાંથી કોઈ પણ માણસને વસ્તુઓ લઈ જવાની પરવાનગી આપવાની ના પાડી. તેણી ઈસુએ લોકોને ઉપદેશ આપ્યો. તેણે કહ્યું; "શાસોમાં તે લખલું છે. 'મારું ઘર બધા લોકો માટેનું પ્રાર્થનાનું ઘર કહેવાશે.' પરંતુ તમે દેવના ઘરને 'ચોરોને છુપાવા માટેની જર્યામાં ફેરવો છો."

ઈમુખ્ય યાજકો અને શાસીઓએ આ બાબતો સાંભળ્યી. તેઓ ઈસુને મારી નાખવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ ઈસુથી ડરતા હતા. કારણ કે બધા લોકો તેના ઉપદેશથી અચરત પામતા હતા. તે રાત્રે, ઈસુ અને તેના શિષ્યોએ તે શહેર છોડ્યું.

ઈસુ વિશ્વાસનું સામર્થ્ય બતાવે છે

અભીજ સવારે ઈસુ તેના શિષ્યો સાથે ચાલતો હતો. તેઓએ અંજીરીનું જાડ જોયું. ઈસુ આગલા દિવસે જે વિષે બોલ્યો હતો. એ અંજીરનું વૃક્ષ તેના મૂળ સાથે સૂકાઈ ગયેલું જોયું. અપિતરે વૃક્ષનું સ્મરણ કરીને ઈસુને કહ્યું, "ઉપદેશક, જી! ગઈ કાલે, તે કહ્યું કે અંજીરીનું વૃક્ષ મૂળમાંથી સૂકાઈ જશે. હવે તે સૂકુ અને મરેલું છે!"

ઈસુએ ઉત્તર આપ્યો; "દ્વામાં વિશ્વાસ રાખો." તેણું તમને સત્ય કહ્યું છું. તમે આ પર્વતને કહી શકો છો, 'જી, પર્વત દરિયામાં પડ.' અને જો તમને તમારી મનમાં શંકા ના હોય અને વિશ્વાસ હોય કે તમે જે કહેશો તે બનશો તો દેવ તે તમારા માટે કરશે. જેતેથી હું તમને કહ્યું છું કે પ્રાર્થનામાં જ સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે. અંજયારે તમે પ્રાર્થના કરો છો, અને તમે યાદ કરો છો કે તમે બીજા કોઈ એક વ્યક્તિ સાથે કંઈક કારણસર ગુસ્સે થયા છો. તો તે વ્યક્તિને માફ કરો."

કલમ ૨૬ કેટલીક પ્રાચીન ગીત નકલામાં કલમ ૨૬ જોડી છે:

"પણ જો તમે બીજાઓને માફ નહિ કરો, તો તમારો પિતા જે

આક્રાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહિ."

યહુદી આગેવાનોની ઈસુના અધિકારની શક્તિ

૩૭ઈસુ અને તેના શિષ્યો ફરીથી યરૂશાલેમ ગયા. ઈસુ મંદિરમાં ચાલતો હતો. મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલ યહુદી આગેવાની ઈસુ પાસે આવ્યા. રૂતેઓએ ઈસુન કહ્યું, “અમને કહે! તને આવા ક્રામો કરવાની કંઈ સત્તા છે? તને આ સત્તા ક્રાપો આપી?”

૩૮ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને એક પ્રશ્ન પૂછીશ. તમે મારા પ્રશ્નનો જવાબ આપો. પછી હું તમને ક્રાની સત્તાથી આ ક્રામો કરું છું તે કહીશ. ઊમને કહો: જ્યારે યોહાન લોકોને બાપ્તિસ્મા આપતો હતો, ત્યારે તે (સત્તા) દેવ પાસથી આવી કે માણસો પાસથી? મને ઉત્તર આપો!”

૩૯આ યહુદી નેતાઓએ ઈસુના પ્રશ્ન વિષે વાતો કરી. તેઓએ એકબીજાને કહ્યું, “જો આપણો ઉત્તર આપીએ. યોહાનનું બાપ્તિસ્મા માણસ પાસેનું હતું.” તો લોકો આપણા પર ગુરુસે થશો.” (આ આગેવાનો લોકોથી બીતા હતા. બધા જ લોકોન વિશ્વાસ હતો કે યોહાન એક પ્રેબોથક હતો.)

૪૦એથી આગેવાનોએ ઈસુને ઉત્તર આપ્યો. “અમે ઉત્તર જાણતા નથી.”

૪૧ઈસુએ કહ્યું, “તો પછી હું તમને કહીશ નહિ કે આ ક્રામો હું કંઈ સત્તાથી કરું છું.”

દેવ તેના પુત્રને મોકલે છે

૧૨ ઈસુ લોકોને ઉપદેશ આપવા માટે વાતાઓનો ઉપયોગ કરતો. “એક માણસે એક બેતરમાં પ્રાક્તાવાડી રોપી અને તે માણસે બેતરની આજુભાજુ દિવાલ બનાવી. અને એક ખાડો ઘોંદી પ્રાક્તસુદૂર બનાવ્યો. પછી તે માણસે બુરજ બાંધ્યો. તે માણસે કેટલાક બેડૂતોને બેતર ઈજારે આપ્યું. પછી તે માણસ પ્રવાસ માટે વિવદ્ય થયો. ઓડા વખત પછી, દ્રાક્ષ ચૂંટવાનો સમય આવ્યો. તેથી તે માણસે તેનો પ્રાક્તનો ભાગ લેવા માટે એક નોકરને બેડૂત પાસે મોકલ્યો. ઉપરંતુ તે બેડૂતોએ નોકરને પકડ્યો અને માર્યો. તેઓએ નોકરને ખાલી હાથ કાઢી મૂક્યો. પછી તે માણસે બીજા એક નોકરને બેડૂતો પાસે મોકલ્યો. તે બેડૂતોએ તેનું માથું ઝોડી નાખ્યું. તેઓએ તેને માટે કોઈ માન બતાવ્યું નહિ. પણ તે માણસે બીજા એક નોકરને મોકલ્યો. તે બેડૂતોએ આ નોકરને મારી નાખ્યો. તે માણસે ઘણા બીજા નોકરોને બેડૂતો પાસે મોકલ્યા. તે બેડૂતોએ કેટલાક બેડૂતોને માર્યો અને બીજાઓને મારી નાખ્યા.”

૪૨તે માણસ પાસે બેડૂતોની પાસે મોકલવા એક વ્યક્તિ જ રહી. આ વ્યક્તિ તે માણસનો પુત્ર હતો. તે માણસ તેના દીકરાને ચાહતો હતો. પરંતુ તે માણસે પુત્રને બેડૂતો પાસે મોકલવાનો નિર્ણય કર્યો. પુત્ર એ છેલ્લી વ્યક્તિ હતી જેને તે મોકલી શકે. તે માણસે કહ્યું, ‘તે બેડૂતો મારુ પુત્રને માન આપશે.’

૪૩પણ બેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ માલિકનો પુત્ર છે. જો આપણે તેને મારી નાખીશું, તો પછી તેનું બેતર આપણું થશે.’ લેથી તે બેડૂતોએ તે પુત્રને મારી નાખ્યો. અને તેને બેતરની બધાર ફંકી દીધ્યો.

૪૪તેથી તે બેતરની જે માલિક હતો તે શું કરશે? તે બેતરમાં જશે અને પેલા બેડૂતોને મારી નાખશે. પછી તે બીજા બેડૂતોને તે બેતર આપશે. ૪૫ખરેખર તમે આ શાસ (લેખ) વાંચ્યો છો:

‘જે પથ્થરનો બાંધકામ કરનારાઓએ અસ્વીકાર કર્યો. તે ખૂણાના મથાળાનો (પથ્થર) થયો.
૪૬ દેવ આ બધુ કર્યું છે, અને તે આપણા માટે અદભુત છે.’

ગીતશાસ ૧૧૮:૨૨-૨૩

૪૭આ યહુદી આગેવાનોએ આ વાર્તા સાંભળી જે ઈસુએ કહી. તેઓએ જાણ્યું કે આ વાર્તા તેઓના વિષે હતી. તેથી તેઓ ઈસુને પકડવાની યુક્તિ શોધવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ લોકોથી બીતા હતા. તેથી તે યહુદી આગેવાનો ઈસુને છાડીને ચાલ્યા ગયા.

યહુદી આગેવાનોનો ઈસુને ફસાવવાનો પ્રયત્ન

૪૮પાછળથી, યહુદી આગેવાનોએ કેટલાક ફરોશીઓને અને હેરોદીઓના નામે જાણીતા સમુહમાંથી કેટલાક માણસોને ઈસુ પાસે મોકલ્યા. તેઓ ઈસુને કાઈક ખોડું કર્ણતા પકડવા ઈચ્છતા હતા. ૪૯ ફરોશીઓએ અને હેરોદીઓ ઈસુ પાસે ગયા અને કહ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું એક પ્રમાણિક માણસ છે. તું તારા વિષે બીજા લોકો જ વિચારે છે તેની જરા પણ દરકાર કરીશ નહિ. બધા માણસો તારી પાસે સરખા છે. અને તું દેવના માર્ગ વિષે સાચો ઉપદેશ આપે છે. તો અમને કહે: કેસરને કર આપવા ઉચિત છે? હા કે ના? આપણે કર આપવા જાઈએ ક આપણો કર ન આપવો જોઈએ?”

૫૦પણ ઈસુએ જાણ્યું કે આ માણસો ખરેખર તેને ફસાવવાનો (પરીક્ષણના) પ્રયત્ન કરતા હતા. ઈસુએ

કહ્યું, "તમે શા માટે મને કઈક ખોટું કહેતા પકડવાનો પ્રયત્ન કરો છો? મને એક ચાંદીનો સિક્કો લાવી આપો. મને તે જોવા દો." ૧૬તેઓએ ઈસુને એક સિક્કો આપ્યો. અને ઈસુએ પૂછ્યું, "સિક્કા પણ ગોનું ચિન્ત છે? અને તેના પર કોનું નામ લખેલું છે?" તેઓએ જવાબ આપ્યો, "તે કેસરનું ચિન્ત છે અને કેસરનું નામ છે."

૧૭પછી ઈસુએ તેઓને કહ્યું, "કેસરની જે વસ્તુઓ છે તે કેસરને આપો. અને દેવની જે વસ્તુઓ છે તે દેવને આપો." ઈસુએ જે કહ્યું તેથી તે માણસો નવાઈ પામ્યા.

કેટલાક સદ્ગીઓનો ઈસુને ફસાવવાનો પ્રયત્ન

૧૮પછી કેટલાક સદ્ગીઓ ઈસુ પાસે આવ્યા. (સદ્ગીઓ માને છે કે કોઈ વ્યક્તિ મૂંબેલામાંથી ઊરી શકે નહિ.) સદ્ગીઓએ ઈસુને એક પ્રશ્ન પૂછ્યો. ૧૯તેઓએ કહ્યું, "ઉપદેશક, મૂસાએ લખ્યું છે કે જો કોઈ પરિણિત માણસ મૃત્યુ પામે અને તેને બાળકો ન હોય, તો પછી તેના ભાઈએ તે સીને પરણાલું જોઈએ. પછી તેઓને તેના મૃત્યુ ભાઈ માટે બાળકો થશે. ૨૦ત્યા સાત ભાઈઓ હતા. પહેલો ભાઈ પરણ્યો પણ મરી ગયો. તેને બાળકો ન હતા. ૨૧ત્થી બીજો ભાઈ તે સીને પરણ્યો. પણ તે પણ મૃત્યુ પામ્યો અને તેને બાળકો ન હતાં. અને ૨૨ બાબત ત્રીજી ભાઈ સાથે બની. ૨૩બધા સાત ભાઈઓ તે સીને પરણ્યા અને મૃત્યુ પામ્યા. ભાઈઓમાંના કોઈનાથી તે સીને બાળકો ન થયા અને છીલ્દી તે સી પણ મરી ગઈ. ૨૪પણું બધા સાત ભાઈઓ તેને પરણ્યા હતા તેથી મૃત્યુ પછી જાથે પુનરુત્થાનનો સમય થશે ત્યારે, આ સી કોની પત્ની થશે?"

૨૫ઈસુએ ઉત્તર આપ્યો, "તમે આ ભૂત શા માટે કરી? શાસ શું કહે છે તે તમે નથી જ્ઞાતા કારણ કે તમે દેવના સામર્થ્ય વિષે નથી જ્ઞાતા. ૨૬જ્યારે લોકો મૂંબેલામાંથી ઊરી ત્યારે ત્યાં એકલીજ સાથે લગ્ન કરશે નહિ. તેઓ આકાશમાંના દૂતો જેવા હશે." ૨૭ખરેખર મૃત્યુ પામેલા લોકો પાછા જોઈ છે તે વિષે દેવ શું કહ્યું છે તે તમે વાંચ્યું છો. જ્યાં મૂસાએ પુસ્તકમાં સણગતી જાડી વિષે લખ્યું છે. તે કહે છે કે દેવ મૂસાને આ કહ્યું છે, 'હું ઈલાહીમનો દેવ, ઈસહાકનો દેવ અને યાકૂબના દેવ છુ.'* ૨૮જો દેવ કહ્યું તે તેઓનો દેવ છે, તો પછી તે માણસો ખરેખર મરેલા નથી. તે ફક્ત જીવતા લોકીનો દેવ છે, તમે સદ્ગીઓ ખોટા છો!"

હું ઈલાહિમ ... દેવ છુ નિ. ૩:૬.

કઈ આજા સૌથી મહત્વની?

૨૬શાસીઓમાંનો એક ઈસુ પાસે આવ્યો. તેણે ઈસુને સદ્ગીઓ અને ફરોશીઓ સાથે દલીલો કરતા સાંભળ્યા. તેણે જોયું કે ઈસુએ તેમના પ્રશ્નોના સારા ઉત્તર આવ્યા. તેથી તેણે ઈસુને પૂછ્યું, "કઈ આજા સૌથી મહત્વની છે?"

૨૭ઈસુએ ઉત્તર આપ્યો, "સૌથી વધારે મહત્વની આજા આ છે: 'ઈજરાએલના લોકો, ધ્યાનથી સાંભળો! પ્રભુ આપણો દેવ છે તે જ ફક્ત પ્રભુ છે. ૩૦તારે પ્રભુ તારા દેવને પ્રેમ કરવો જોઈએ. નારે તને તારા પૂરા હદ્યથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી, ને તારા પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ.'* ૩૧જીજી સૌથી મહત્વની આજા આ છે: 'તું તારી જીતને પ્રેમ કરે છુ જ રીત તારે તારા પાડોશી પર પ્રેમ કરવો જોઈએ.'* આ બં આજાઓ સૌથી અગત્યની છે."

૩૨તે માણસે ઉત્તર આપ્યો. "તે એક સારો ઉત્તર હતો. ઉપદેશક, જ્યારે તે આ બાબતો કહી તું સાચો હતો. દેવ જ ફક્ત પ્રભુ છે, અને બીજો કોઈ દેવ નથી. ૩૩અને વ્યક્તિએ દેવને પૂરા હદ્યથી, પૂરા મનથી, પૂરા સામર્થ્યથી પ્રીતિ કરવી જોઈએ. અને વ્યક્તિ તેની જીતને પ્રેમ કરે છે તે જ રીતે પડોશીને પ્રેમ કરવો જોઈએ. આ આજાઓ, દેવને અર્પિત બધા જ પ્રાણીઓ અને બલિદાનાથી પણ વધારે મહત્વની છે."

૩૪ઈસુએ જોયું કે માણસે તેને ડહાપણથી ઉત્તર આપ્યો. તેણે ઈસુએ માણસને કહ્યું, "તું દેવના રાજાની નજીક છો." અને તે પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્નો પૂછ્યાની હિમ્મત ન કરી.

૩૫ઈસુ મંદિરમાં ઉપદેશ આપતો હતો. ઈસુએ પૂછ્યું, "શા માટે શાસીઓ કહે છે કે જિસ્ત એ દાઉદનો દીકરો છે? ૩૬પવિત્ર આત્માની મદદથી, દાઉદ તેની જાતે કહે છે:

'પ્રભુને (દેવ) મારા પ્રભુને (ખિસ્તને) કહ્યું: મારી પાસે જમણી બાજુએ બેસ, અને હું તારા દુશ્મનોને તારા અંકુશમાં મૂકીશ.'

ગીતશાસ ૧૧૦:૧

૩૭દાઉદ તેની જાતે જિસ્તને 'પ્રભુ' કહે છે. તેથી જિસ્ત કેવી રીતે દાઉદનો દીકરો હોઈ શકે? ધરા લોકોએ ઈસુને સાંભળ્યો અને તેઓ ધરા ખુશ થયા હતા.

ઈજરાએલના લોકો ... પ્રેમ કરવો જોઈએ' પુન. ૬:૪-૫

'હું તારી જીતને ... પ્રેમ કરવો જોઈએ' લે. ૧૬:૧૮.

૩૬ઈસુએ ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું. ઈસુએ કહ્યું, “શાસીઓથી સાવધાન રહો. તેઓને કપડા પહેરીને આજુબાજુ ફરવાનું જે મહત્વનું દેખાય, તે ગમે છે. અને લોકો બનારાના સ્થળોએ તેમને માન આપે તે તેઓને ગમે છે. ૩૭તેઓને સભાસ્થાનોમાં સૌથી મહત્વની બેઠકો પ્રાપ્ત થાય, તે ગમે છે. અને મિજબાનીઓમાં પણ તેઓને સૌથી મહત્વની બેઠકો મળે તે ગમે છે. ૩૮તેઓ વિધવાઓના સાધન અને તેમના ઘરો પડાવી લે છે. પછી તેઓ તેમની જાતે સારા દેખાવાનો પ્રયત્ન લાંબી પ્રાર્થનાઓ કરીન કરે છે. દેવ તેઓને ઘડી બધી શિક્ષા કરશે.”

વિધવા આપવાનો અર્થ બતાવે છે

૩૯ઈસુ મંદિરમાં દાનપેટી નજીક બંઠો. જ્યાં લોકો તેઓની ભેટો મૂકીતા. લોકો પેટીમાં પેસા નાખતા તે જોતા. ઘણા ઘનવાન લોકી ઘણા પેસા આપતા. ૪૦પછી એક ગરીબ વિધવા આવી અને તેણે બે ઘણા નાના તાંબાના સિક્કા આપ્યા. આ સિક્કાઓની ડિમત એક દમડી પણ ન હતી.

૪૧ઈસુએ તેના શિષ્યોને બોલાવ્યા. ઈસુએ કહ્યું; “હું તમને સાચું કહું છું. આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા. પણ તેણે ખરેખર બધા ઘનવાન માણસો કરતા વધારે આપ્યું છે. ૪૨આ લોકો પણ પુષ્કળ છે. તેઓએ તો ફક્ત તમને જેની જરૂર નથી તે જ આપ્યું. પણ તેણે તો તેના જીવન જીવા માટે જરૂર હતું તે બધું જ નાણું આપ્યું.”

મંદિરનું વિનાશાત્મક ભાવિ

૧૩ ઈસુ મંદિરમાંથી વિદ્યાય લેતો હતો તેના શિષ્યોમાંના એકે કહ્યું, “જો, ઉપદેશક! આ મંદિરમાં ઘણા આકર્ષક મકાનો અને ઘણા મોટા પથરો છે.”

ઈસુએ કહ્યું, “તમે આ મોટાં બાંધકામો જુઓ છો? આ બધાં બાંધકામોનો વિનાશ થશે. દરેક પથર જીની પર ફંકવામાં આવશે. એક પણ પથર ન્યાં રહેવા દેવામાં આવશે નહિ.”

આછળથી, ઈસુ જૈતૂનના પહાડ પર એક જગ્યાએ બંઠો હતો. તે પિતર, ચાકૂબ, યોહાન તથા આન્દિયા સાથે એકલો હતો. તેઓ બધા મંદિરને જોઈ શક્યા. પેલા શિષ્યોએ ઈસુને પૂછ્યું. ૪૩“અમને કહે, આ કારે બનશે? અને આ સમય બનવા માટેનો છે તે બાબતે અમને કઈ નિશાની બતાવશે?”

૪૪ઈસુએ શિષ્યોને કહ્યું, “સાવધાન રહો! કોઈ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે. ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કહેશે, ‘હું એ છુ’ અને તેઓ ઘણા લોકીને છિતરશે. ૪૫તેમે યુદ્ધ વિષે સાંભળશો અને યુદ્ધોની અફવાઓ વિષે સાંભળશો. પણ ગમ્ભરાશો નહિ. આ વસ્તુઓ તેણો અંત થતા પહેલા થશે. ૪૬રો બીજા રાજો સામે લડશે. અવો સમય આવશે જ્યારે લોકીને માટે બાવાનું પણ નહિ હોય. અને ત્યાં જુદા જુદા સ્થળોએ ઘરસીકપ થશે. મહા દુઃખનો આ તો આરંભ છે. બાળક જન્મતા પહેલા થતી પીડાઓ જેવી આ વસ્તુઓ છે.

૪૭“પોતા વિષે સાવધાન રહેવું જોઈએ. લોકો તમને પકડશે અને તમને ન્યાય માટે લઈ જશે. તેઓ તમને તેમના સભાસ્થાનમાં મારશે. તમને રાજ્યપાલ અને રાજાઓ સામે ઊભા રાખવામાં આવશે. તમે તેઓને મારા વિષે કહેશો. આ તમારા જીવનમાં બનશે કારણ કે તમે મને અનુસરો છો. ૪૮આ વસ્તુઓ બને તે પહેલા બધા લોકીને સુવાત્તાં પહુંચયી જોઈએ. ૪૯તમને પકડવામાં આવશે અને ન્યાય થશે. પરંતુ તમારે શું કહેવું જોઈએ તેની ચિંતા અગાઉવી ના કરશો. તે સમયે દેવ તમને જ આપે તે કહેશો. તે વખત ખરેખર તમે બોલશો નહિ પણ તે પવિત્ર આત્મા બોલનાર છે.

૫૦“ભાઈઓ પોતાના ભાઈઓની વિરુદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. પિતા પોતાના બાળકોની વિરુદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. બાળકો તેમના માતાપિતાની વિરુદ્ધ થશે અને તેમના માબાપને મારી નંખાવવાના રસ્તા શોધશે. ૫૧અથ લોકો તમને વિકારશે. કારણ કે તમે મને અનુસરો છો. પણ જે વ્યક્તિ અંત સુધી કરશે તેનું તારણ થશે.

૫૨“જેનાં કારણે વિનાશ થશે એવી ભયંકર વસ્તુ તમે જોશો. જ્યાં તેને ન હોવું જોઈએ, તે જગ્યાએ તે ઊભી રહેલી હશે.” (જે આ વાચે છે તેમણે સમજજીવ.) “તે સમયે, યહુદીયામાંથી લોકોએ પહાડો તરફ નાસી જવું જોઈએ. ૫૩કોઈ પણ વસ્તુ માટે રોકાયા વિના સમય બગાડા વિના લોકોએ ભાગી જવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તેના ઘરના ઘાપરા ઉપર હોય તો તેણે તેના ઘરમાંથી કઈ પણ લેવા સારું નીચે જવું જોઈએ નહિ. ૫૪જો કોઈ વ્યક્તિ ખેતરમાં હોય તો તેણે તેનો ડગલો લેવા પાણ જવું ન જોઈએ. ૫૫તે સમય સીઓ જ ગર્ભવતી છે અથવા જેને ઘણણાં બાળકો છે, તેઓ માટે ઘણું ખરાબ હશે. ૫૬અને (તમારું નાસવુ) શિયાળામાં ન થાય તે માટે પ્રાર્થના કરો. ૫૭શા માટે? કારણ કે તે

દિવસો દરમિયાન ઘણી મુશ્કેલીઓ હશે. શરૂઆતમાં દેવ જ્યારે આ જગત બનાવ્યું ત્યારે જે કંઈ બન્યું હતું તેના કરતા વધારે મુશ્કેલીઓ ઊભી થશે અને આવી મુશ્કેલીઓ ફરીથી આરેય બનશે નહિ. ૨૦તે ભયંકર સમયને ટૂંકો કરવાનો નિર્ણય દેવે કર્યા છે. જો તે સમયને ટૂંકો કરવામાં ન આવ્યો હોત તો પછી કોઈ વ્યક્તિ જીવતી રહી શકી ના હોત. પણ દેવે તેણે પસંદ કરેલા તેના ખાસ લોકોને માટે તે સમય ટૂંકો કર્યા છે. જેને સમયે કેટલીક વ્યક્તિઓ તમને કહેશે, ‘જુઓ, અહીં પ્રિસ્ત છે! અથવા બીજુ એક વ્યક્તિ કહેશે, તે ત્યાં છે! પણ તેમનું માનશો નહિ. રજૂણા વિસ્તો અને જૂણ પ્રબોધકો આવશે અને મહાન કામો અને અદ્ભૂત ચ્યાત્રારો કરશે. તેઓ આ કામો દેવે પસંદ કરેલા લોકો આગળ કરશે, જો શક્ય હશે તો તેઓ આ કામો કરીને તેના લોકોને છિંતરવાનો પ્રયત્ન કરશે. ૨૧તેથી સાવધાન રહો, હવે મેં તમને આ બધું બનતા પહેલા તે વિષે ચેતવણી આપી છું.”

૨૨“તે દિવસો દરમિયાન આ વિપત્તિઓ પછી,

‘સૂર્ય અંધકારદ્રષ્ટ થઈ જશે, અને ચંદ્ર તેનો પ્રકાશ આપશે નહિ.’

૨૩ આકાશના તારાઓ ખરવા લાગશે, અને આકાશના પરાકમો હલાવાશે.”

વશાયા ૧૩:૧૦; ૩૪:૪

૨૪“પછી લોકો માણસના પુત્રને ઘણાં પરાકમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશો. ૨૫માણસનો પુત્ર પૃથ્વીની ચારેબાજુ તેના દૂંગને મોકલશે. દૂંગો પૃથ્વી પરના દરેક ભાગોમાંથી તેના પસંદ કરેલા લોકોને ભેગા કરશે.”

૨૬“અંજુરીનું વૃક્ષ આપણને એક બોધપાઠ શીખવે છે. જ્યારે અંજુરીના વૃક્ષની ડાળીઓ લીલી અને નરમ બને છે અને નવા પાંડડા ઊગવાની શરૂઆત થાય છે ત્યારે તમે જાણો છો કે ઉનાણો નજીક છે. ૨૭આ વસ્તુઓ સાથે એવું જ છે જે મેં તમને કંધું તે બનશે જ. જ્યારે તમે આ બધું બનતું જોશો, ત્યારે તમે જાણશો કે તે સમય* નજીક છે. ૩૦હું તમને સત્ય કહું છું. જ્યારે આ સમયના લોકો જીવતા હશે ત્યારે જ આ બધી વસ્તુઓ બનશે. ૩૧આખી પૃથ્વી અને આકાશનો વિનાશ

સમય જ્યારે કંઈક મહત્વનું સમયમાં બનવાનું છે તેના વિષે ઈસુનું કહે છે. જૂઓ લૂક. ૨૧:૩૧, જ્યાં ઈસુને કંધું છે કે દેવનું રજય આવવાનો આ સમય છે.

થશે. પણ જે વાતો મેં કહી છે તે કદાચિ નાશ પામશે નહિ.”

૩૨કોઈ વ્યક્તિ જાણતી નથી કે કયા દિવસે કયા સમયે તે થશે. તે પુત્ર અને આકાશના દૂંગો પણ તે જાણતા નથી. કક્ત પિતા જ જાણે છે. ઉચ્ચાવધાન રહો! હુમેશા તૈયાર રહો! તમને ખબર નથી તે સમય કારે આવશે. ૩૩એક માણસ તેનું ઘર છોડીન પ્રવાસમાં જાય છે તેના જેવું આ છે. તે માણસ તેના ઘરની સંભાળ લેવાનું તેના સેવકીને સોંપે છે. તે દરેક સેવકને ખાસ સેવા કરવાનું ક્રમ સોંપે છે. એક સેવકને દરવાજાની ચોકી કરવાનું ક્રમ છે. તે માણસ આ સેવકને હુમેશા તૈયાર રહેવાનું કહે છે. હમણા હું તમને કહું છું તે એ જ છે. ૩૪તેથી તમારે હુમેશા તૈયાર રહેવું જાઈએ, તમે જાણતા નથી, ઘરનો માલિક સાંજે, મધરાતે કે વહેલી સવારે કે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે કદાચ આવે. ૩૬એને તે માલિક એકાએક પાછો ઝડપથી પણ આવે. જો તમે હુમેશા તૈયાર રહો તો પછી તે તમને ઊંઘતા જોશ નહિ. ૩૭હું તમને આ કહું છું, અને હું આ પ્રાન્યક વ્યક્તિને કહું છું: ‘તૈયાર રહો!’”

ઈસુને મારી નાખવાનું યહૂદી આગેવાનોનું કાવતનું

૧૪ પાસખા અને બખમીર રોટલીના પર્વના* ફક્ત બે દિવસ પહેલાનો વખત હતો, મુખ્ય યાજકો અને શાસીઓ ઈસુને પકડવા માટે કંઈક જૂણાણાનો ઉપયોગ કરવાનો રસ્તો શાખવાનો પ્રયત્ન કરતો હતા. પછી તેઓ તેને મારી નાખી શકે. જેઓએ કંધું, “પણ અમે પર્વ દરમિયાન ઈસુને પકડી શકીએ નહિ. અમે ઈચ્છતા નથી કે લોકો ગુંસે થાય અને હુલ્લડનું કરાશ બને.”

એક સીનું કંઈક વિશિષ્ટ કાર્ય

ઈસુ બેથનિયામાં હતો. તે સિમાન કોણિયાના ઘરમાં ખાસો હતો. જ્યારે ઈસુ ત્યાં હતો, ત્યારે એક સી તેની પાસે આવી. તે સી પાસે ક્રીમતી અતારથી ભરેલી સર્ગેમરમરની શીશી હતી. આ અતાર શુદ્ધ જટામાસીમાંથી બનાવેલું હતું. તે સીએ તે શીશી ભાંગી નાખી અને ઈસુના માથા પર તે અતાર રેઝું.

૩૮ત્યાં કેટલાએક શિષ્યોએ આ જોયું તેઓ નારાજ થયા અને એકબીજાને ફરિયાદ કરવા લાગ્યા. તેઓએ

બખમીર રોટલીનું પર્વ મહત્વનું યહૂદી પવિત્ર અઠવાડિયું, જૂણ કરારના સમયમાં પાસ્ખા પછી શરૂ થતો દિવસ, પણ આ સમય દરમાન બે પર્વો એક બન્યા છે.

કંદું, "તે અતરનો બગાડ શા માટે કરવો જોઈએ? પણ અતરનું મૂલ્ય આપા વર્ષની કમાણી જેટલું છે. તે વેચી શકાયું હોત અને પેસા ગરીબ લોકોને આપી શકા હોત." અને તેઓએ તે શીની કડક ટીકા કરી.

ઈસુએ કંદું, "તે સીની ચિંતા ના કરો. તમે શા માટે તેને સત્તાઓ છો? તેણે મારા માટે ઘણું સારું ક્રમ કર્યું છે. જીતમારી સાથે સદાય ગરીબ લોકો હશે, તમે ઈચ્છા તે સમયે તેમને મદદ કરી શકો છો. પણ હું હમેશા તમારી સાથે નથી. આ સીએ ફક્ત તે ક્રમ કર્યું જે મારે માટે તેનાથી થઈ શકે, તેણે અતર મારા શરીર પર રેઝું. મારા મરતાનો પહેલા મારા દફન માટે આગાઉથી તેણે આ કર્યું. હું તમને સત્ય કર્યું છું. સુવાર્તા આખી દુનિયામાં લોકોને જગ્ઞાવવામાં આવશે. અને દરેક જગ્ઞાએ જ્યાં સુવાર્તા જગ્ઞાવાશે, ત્યાં આ સીએ જે કર્યું તેની વાત પણ કહેવાશે. તેણે જે કર્યું છે તેની વાતો થશે અને લોકો તેને યાદ કરશે."

ઈસુના દુષ્મનોને મદદ કરવા યહૃદાસંભત

૧૦પણી બાર પ્રેરિતોમાનો એક મુખ્ય યાજકોને કહેવા માટે ગયો. આ યહૃદા ઈશ્વરિયોન નામનો શિષ્ય હતો, તે તેઓને ઈસુને સંપવા ઈચ્છાતો હતો. "મુખ્ય યાજકો આ વિષે જાણી ધણા પ્રસન્ન હતા. તેઓએ યહૃદાને આ કરવા માટે પેસા આપવાનું વચન આપ્યું. તેથી યહૃદા ઈસુને સંપવાની ઉત્તમ સમયની રાહ જોતો હતો.

પાસ્થાપર્વ

જુદે તે બેખ્મીર રોટલીના પર્વનો પ્રથમ દિવસ હતો. આ સમયે યહૃદીઓ હમેશા પાસ્થાપર્વમાં ઘટાંઓના બલિદાન કરતા. ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કંદું, "અમે જઈશું અને પાસ્થા ભોજન જમવા તારે માટે દરેક વસ્તુઓ તૈયાર કરીશું. ભોજન માટે અમે કર્યાં જઈએ એ વિષે તારી ઈચ્છા શી છે?"

ઈસુએ તેના શિષ્યોમાંથી બે જગ્ઞાને મોકલ્યા. ઈસુએ તેઓને કંદું, "શહેરમાં જ્યાં, તમે એક માણસને પાણીની ગાગર લઈને જતા જાશો. તે માણસ તમારી પાસે આવશે. તે માણસની પાછળ જાઓ. તે માણસ એક ઘરમાં જશે. તે વ્યક્તિને ઘરનો માલિક છે તેને કહો, 'ઉપદેશક પૂછે છે કે તમે અમને તે ઓરડો બનાવો કર્યાં તે અને તેના શિષ્યો પાસમાં ભોજન આઈ શક.' આ મેરી તમારા માટે તૈયાર છે. આપણાં માટે ત્યાં ભોજન તૈયાર કરો."

"તેથી શિષ્યો વિદાય થયા ને તે શહેરમાં ગયા. ઈસુએ કહેવી દરેક બાબત એ પ્રમાણે બની. તેથી શિષ્યોએ પાસ્થા ભોજન તૈયાર કર્યું.

૧૨સાંકે, ઈસુ બાર પ્રેરિતો સાથે તે ઘરમાં ગયો. ૧૩બારે તેઓ બધા ખાતા હતા ત્યારે ઈસુએ કંદું, "હું તમને સત્ય કર્યું છુ. તમારા બારમાનો એક મારી વિરુદ્ધ થશે, તમારામાનો એક હમણા મારી સાથે ખાય છે."

૧૪શિષ્યો આ સાંભળીને ધણા દિલગીર થયા. દરેક શિષ્ય ઈસુને ખાતરી આપી, "ખરેખર તારી વિરુદ્ધ થનાર તે હું નથી!"

૧૫ઈસુએ જિતર આપ્યો, "તે માણસ જે મારી વિરુદ્ધ છે તે તમારા બારમાનો એક છે. જે તેની રોટલી મારી સાથે એક જ વાટકામાં બોળે છે તે જ તે છે. ૧૬માણસનો પુત્ર જશે અને મૃત્યુ પામશે. તે લખાણો કહે છે, 'આ બનશે પરતુ જે માણસના પુત્રને મારી નાખવા માટે સોંપવાનો છે તે વ્યક્તિ માટે તે ઘણું ખરાબ હશે. તે વ્યક્તિ કદાપિ જન્મ્યો ન હોત તો તે તેને માટે વધારે સારું થાત.'"

પણ ભોજન

૧૭બારે તેઓ ખાતો હતો, ત્યારે ઈસુએ રોટલી લીધી. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને રોટલીના ભાગ પાઢા. તેણે રોટલી તેના શિષ્યોને આપી. ઈસુએ કંદું, "આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે."

૧૮પણી ઈસુએ દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને તેણે તે માટે દેવનો આભાર માન્યો અને તે શિષ્યોને આપ્યો. બધા જ શિષ્યોએ તે પ્યાલામાંથી પીધું.

૧૯પણી ઈસુએ કંદું, "આ દ્રાક્ષારસ મારું લોહી છે. મારું લોહી (મરણ) દેવ તરફથી તેના લોકો સાથે નવા કરારનો આરંભ કરે છે. આ લોહી ધણા લોકો માટે વહેવાદપવામાં આવ્યું છે. ૨૦હું તમને સત્ય કર્યું છુ, હવે પછી હું આ દ્રાક્ષારસ પીનાર નથી. જ્યારે હું દેવના રાજ્યમાં તે પીશ ત્યારે તે દ્રાક્ષારસ નવો હશે."

૨૧બધા શિષ્યોએ જીત ગણ્યું પછી તેઓ જેતુનના પર્વત તરફ ગયા.

ઈસુના બધા શિષ્યોનું તેને છોડી જવું

૨૨પણી ઈસુએ શિષ્યોન કંદું, "તમે બધા તમારો વિશ્વાસ ગુમાવશો. શાસમાં તે લખાયેલું છે:

'હું પાળકને મારી નાખીશ, અને ઘટાંઓ નાસી જશે.'

જાગ્યાં ૧૩:૭

૨૮પરંતુ મારા મૃત્યુ પછી, મૃત્યુમાંથી સજીવન થઈને હું ગાલીલમાં જઈશ. હું ત્યાં તમારા જતાં પહેલા હોઈશ."

૨૯પિતરે કહ્યું, "બીજા બધા શિષ્યો તેમનો વિશ્વાસ કદાચ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કરી ગુમાવીશ નહિ."

૩૦ઈસુએ ઉત્તર આપ્યો, "હું તને સત્ય કહું છું, આજે રાતે તું કહીશ કે તું મને ઓળખતો નથી. મરણો બે વાર બોલે તે પહેલા તું આ ન્યાય વાર અનું કહીશ."

૩૧પણ પિતરે દટ્ટાપૂર્વક ખાતરી આપી, "હું કદીય કહીશ નહિ કે હું તને ઓળખતો નથી અને જરૂર હશે તો હું તારી સાથે મૃત્યુ પણ પામીશા!" અને બીજા બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.

ઈસુ એકલો પ્રાર્થના કરે છે

૩૨ઈસુ અને તેના શિષ્યો ગેથરેમાને નામે એક સ્થળે ગયો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, "જ્યારે હું પ્રાર્થના કરું ત્યારે અહીં બેસો." ૩૩ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને તેની સાથે આવવા કહ્યું પછી ઈસુની વધારે મુશ્કેલીઓની શરૂઆત થઈ અને તે ઘણો ઉદાસ થયો. ૩૪ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને કહ્યું, "મારો આત્મા દુઃખથી ભરેલો છે. મારું હદ્દય દુઃખથી ભાગ્યો પડે છે. અહીં રાહ જુઓ અને આગતા રહો." ૩૫ઈસુ તેઓથી થોડો આગળ ગયો. પછી ઈસુ ભૌય પર પડ્યો અને પ્રાર્થના કરી. ઈસુએ પ્રાર્થના કરી કે, 'જો શક્ય હોય તો, આ પીડાની ઘડી મારાથી દૂર થાયો.' ૩૬ઈસુએ પ્રાર્થના કરી, "અભ્યા, પિતા! તારથી બધું થઈ શકે છે. આ પીડાનો પ્યાલો મારાથી દૂર કર પણ તારી ઈચ્છા પ્રમાણે કર. હું ઈચ્છુ તે નહિ."

૩૭પછી ઈસુ તેના શિષ્યો પાસે ગયો તેણે તેઓને ઉદ્ઘન્તા જોયા. તેણે પિતરને કહ્યું, "સિમોન, તું શા માટે ઉદ્ઘ છો? તું મારી સાથે એક કલાક જાગો ના રહી શકે? ૩૮આગતા રહો અને પ્રાર્થના કરો કે તમને લલચાવવામાં ન આવે. જે સાચું છે તે કરવા તમારો આત્મા ઈચ્છે છે. પણ તમારું શરીર નબળું છે."

૩૯ફરીથી ઈસુ ચાલ્યો ગયો અને એ જ શબ્દોમાં પ્રાર્થના કરી. ૪૦પછી ઈસુ શિષ્યો પાસે પાછો ગયો. ફરીથી ઈસુએ તેઓને ઉદ્ઘન્તા જોયા. તેઓની આંખો ખૂબ થાકેલી હતી. શિષ્યોને ખબર નહોંતી કે તેઓએ ઈસુને શું કહું જોઈએ.

૪૧ત્રીજી વખતની પ્રાર્થના કર્યા પછી ઈસુ તેના શિષ્યો પાસે પાછો ગયો. ઈસુએ તેઓને કહ્યું, "તમે હજુ પણ ઉદ્ઘ છો અને આરામ કરો છો? તે પૂરતું છો! માણસના

પુત્રને પાપી લોકોને આપવા માટેનો સમય આવ્યો છે.

૪૨ ઉભા થાઓ! આપણે જવું જોઈએ. અહીં તે માણસ આવે છે જે મને પેલા લોકોને સંપવાનો છે."

ઈસુ પકડાય છે

૪૩જ્યારે ઈસુ હજુ બોલતો હતો તે જ પળે યહૂદા ત્યાં આવ્યો. યહૂદા એ બાર પ્રેરિતામાંનો એક હતો. યહૂદા સાથે ઘણા લોકો હતા. આ લોકો મુખ્ય યાજકો, શાસ્કીઓ અને વડીલ યહૂદી આગેવાનોમાંથી મોકલવામાં આવ્યા હતા. યહૂદા સાથેના આ લોકો પાસે તલવારો અને સોટા હતા.

૪૪લોકોને કંયે માણસ ઈસુ હતો તે ભતાવવા કરીક કરવા માટેની યોજના યહૂદાએ કરી હતી. યહૂદાએ કહ્યું, "જ માણસને હું ચૂમીશ તે ઈસુ છે. તેને પકડો અને જ્યારે તમે તેને દૂર ઢોરી જાઓ ત્યારે તેની ચોકી કરો."

૪૫તેથી યહૂદા ઈસુ પાસે ગયો અને કહ્યું, "રાખ્યા!" પછી યહૂદા ઈસુને ચૂચ્યો. ૪૬પછી તે માણસોએ ઈસુને ધ્યાં અને તેને પકડ્યા. ૪૭ઈસુની નજીક ઉભેલા શિષ્યોમાના એક તેની તલવાર તાણી અને બેચીને બહાર શાઢી.આ શિષ્યે મુખ્ય યાજકના નોકરને માર્યા અને તલવારથી તેનો કાન કાપ્યો નાખ્યો.

૪૮પછી ઈસુએ કહ્યું, "હું એક ગુનેગાર હોઉં એમ તમે મને પકડવા તલવારો અને સોટા લઈને આવ્યા છો શુ? ૪૯પ્રતિદિન હું મંદિરમાં ઉપદેશ આપતી વખતે તમારી સાથે હતો. તમે મને ત્યાં પકડી શક્યા નહિ પરંતુ આ બધી વસ્તુઓ બની જે શાસ્કમાં કંધા પ્રમાણે જ છે." ૫૦પછી ઈસુના બધા શિષ્યો તેને મૂકીને દૂર નાસી ગયા.

૫૧યાં ઈસુની પાછળ એક જુવાન માણસ આવતો હતો. તેણે ફકન શાશ્વતનું વસ્ત ઓઠેલું હતું. લોકોએ પણ આ માણસને પકડ્યો. ૫૨તેણે ઓઠેલું શાશ્વતનું વસ્ત છૂટું થઈ ગયું અને તે ઉધાડા શરીરે નાસી ગયો.

યહૂદી આગેવાનો સમક્ષ ઈસુ

૫૩ લોકો જેમણે ઈસુને પકડ્યો હતો તેઓ તેને પ્રમુખ યાજકને ઘેર લઈ રહ્યા હન. બધા આગળ પડતાં યાજકો, વડીલ યહૂદી આગેવાનો અને શાસ્કીઓ ત્યાં ભેગા થયા હતા. ૫૪પિતર ઈસુની પાછળ પ્રમુખ યાજકના ઘેર ચોકમાં આવ્યો. પિતર ત્યાં ચોકીદારો સાથે બઢો હતો. તે અંગારથી તાપતો હતો.

૫૫મુખ્ય યાજકો અને યહૂદીઓની ન્યાયની સભાએ ઈસુને મારી નાખી શકાય તે માટે કાઈક ખોટી સાકી ઈસુની વિરુદ્ધ શોધવા પ્રયત્ન કર્યો. પરંતુ તે શોધી શકા નહિ. ૫૬ધ્રા લોકો આવ્યા અને ઈસુ માટે ખોટી સાકી આપી પણ તે બધાએ જુદી જુદી વાતો કહી. તેઓ એકનીજા સાથે સંમત ન હતા.

૫૭પછી કેટલાએક લોકો ઉભા થયા અને ઈસુની વિરુદ્ધ કાઈક ખોટું પ્રમાણપત્ર આપ્યું. તેઓએ કંધું, ૫૮“અમે આ માણસને (ઈસુ) અમ કહેતા સાંભળ્યો છે, ‘હું આ મંદિરનો વિનાશ કરીશ જેને માણસોએ બનાવ્યું છે. અને હું ત્રણ દિવસમાં બીજું એક મંદિર બાંધિશ જે માણસોએ બનાવેલું નહિ હોય.’” ૫૯પણ આ લોકો જે બાબતો કહેતા હતા તે એકબીજા સાથે મળતી આવતી ન હતી.

૬૦પછી પ્રમુખ યાજક બધા લોકોની આગળ ઉભા થયો અને ઈસુને કંધું, “આ લોકો તારી વિરુદ્ધ જે બાબત કહે છે, તારી ઉપરના આ તહોમતો વિષે તારી પાસે કાઈક કહેવાનું છે? શું આ લોકો સાચું કહે છે?” ૬૧પણ ઈસુ કાઈ બોલ્યો નહિ, તેણે કોઈ ઉત્તર આપ્યો નહિ.

તે પ્રમુખ યાજક ઈસુને બીજો એક પ્રશ્ન પૂછ્યો: “શું તું સ્તુતિમાન દેવનો પુત્ર પિસ્ત છે?”

૬૨ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું દેવનો પુત્ર છું અને બવિષ્યમાં તમે માણસના પુત્રને તેના (દેવ) પરાકરમની જમજી બાજુએ બેઠેલો જોશો. અને તમે માણસના પુત્રને આકાશના વાદળો પર આવતો જોશો.”

૬૩ઝારે પ્રમુખ યાજક આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુરુસે થયો. તેણે તેનાં વસો કાડી નાખ્યાં અને કંધું, “અમારે કોઈ વધારાના સાકીઓની જરૂર નથી. ૬૪તમે બધાએ તેને દેવની વિરુદ્ધ આ બાબત કહતાં સાંભળ્યો છે. તમે શું વિચારો છો?”

બધા લોકોએ કંધું કે ઈસુ ગુનેગાર છે. તેઓએ કંધું કે તે ગુનેગાર છે અને તેને મારી નાખવો જોઈએ. ૬૫પણ કેટલાએક લોકો ઈસુ પર થુક્યા. તેઓએ ઈસુની આંખો ઢાંઢી દીધી અને તેના પર તેમની મુક્કીઓએ પ્રાણ કર્યો. તેઓએ કંધું, “અમને કહી બતાવ કે તું એક પ્રબોધક છો!” પછીથી ચોકીદારો ઈસુને દૂર દૂરી ગયા અને તેને માર્યો.

તે ઈસુને જાણે છે તેનું કહેવામાં પિતરનો ડર

૬૬તે સમયે પિતર હજુ પણ ચોકમાં હતો. પ્રમુખ યાજકની એક દાસી પિતર પાસે આવી. ૬૭તે દાસીએ

પિતરને અભિથી તાપતા જોયો. તે પિતરને નજીકથી જોવા લાગી.

પછીથી તે દાસીએ કંધું, “તું નાઝરેથના માણસ ઈસુ સાથે હતો.”

૬૮પરંતુ પિતરે કંધું કે તે કદી ઈસુ સાથે ન હતો. તેણે કંધું, “તું શાના વિષે વાતો કરે છે તે તે હું જાગતો કે સમજતો નથી.” પછી પિતર વિદાય થયો અને ચોકના પ્રવેશદ્વાર તરફ ગયો.*

૬૯દાસીએ પિતરને ત્યાં જોયો. કરીથી તે દાસીએ લોકોને જેણો ત્યાં ઉભા હતા તેઓને કંધું, “આ માણસ પેલા લોકોમાંનો એક છે જે ઈસુની પાછળ ગયો છે.”

૭૦કરીથી પિતરે કંધું, તે સાચું નથી.

થોડાક સમય પછી કેટલાક લોકો પિતરની નજીક ઉભા હતા, તે લોકોએ કંધું, “તું તે લોકોમાંનો એક છે જે ઈસુને અનુસર્યા છે. તું ગાવીલથી ઈસુની જેમ જ આવ્યા છે.”

૭૧પછી પિતરે શાપ આપવાની શરૂઆત કરી. તેણે દ્રઢાનથી કંધું, “હું દેવના સાગન ખાઈને કહુ છું કે આ માણસને હું ઓળખતો નથી.”

૭૨પછી પિતરના આમ કલ્યાં પછી મરધો બીજુ વાર બોલ્યો, પછી ઈસુએ તેને જે કંધું હતું તે પિતરે યાદ કર્યું. “મરધો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વખત કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી પિતર ઘણો દિલગીર થયો અને તે પર મન લગડીને રડ્યો.

હાકેમ પિલાત ઈસુને પ્રશ્નો પૂછું છે

૭૩હાકેમી સવારનાં મુખ્ય યાજકો, વડીલ યહૂદી આગેવાનો, શાસીઓ અને યહૂદીઓની આખી ન્યાયસભાએ ઈસુનું શું કરવું તે અંગે નિર્ણય કર્યો. તેઓએ ઈસુને બાંધ્યા અને તેને હાકેમ પિલાત પાસે લઈ ગયા. તેઓએ ઈસુને પિલાતને સૌખ્યો.

૭૪પિલાતે ઈસુને પૂછિયું, “શું તું યહૂદીઓનો રાજા છો?”

ઈસુએ ઉત્તર આપ્યો, “હા, તે સાચું છે.”

૭૫મુખ્ય યાજકોએ ઈસુ પર ઘણાં તહોમત મૂક્યાં. તેથી પિલાતે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછ્યો. પિલાતે કંધું, “તું જોઈ શકે છે કે આ લોકોએ કેટલાં બધાં તારા પર તહોમત મૂક્યાં છે. તું ઉત્તર કેમ આપતો નથી?”

૭૬પણ ઈસુએ હજુ પણ ઉત્તર આપ્યો નહિ. પિલાતને ઘણું આશ્રમ થયું હતું.

કલમ ૬૮ ઘણી ગીક નકલામાં ઉમેર્યું છે: “એટલે મરધો બોલ્યો.”

ઈસુને મુક્તિ આપવામાં પિલાતનો નિષ્ણળ પ્રયત્ન

જ્યાતિવર્ષ પાસ્થાપર્વના સમયે હાડેમ એક વ્યક્તિને જેલમાંથી મુક્ત કરી શકતો હતો. લોકો જેને મુક્તિને આપવા ઈચ્છતા હોય તે વ્યક્તિને તે મુક્ત કરી શકે. ૧૦ વખતે જેલમાં બરબાસ નામનો માણસ હતો. તે જેલમાં હુલ્લડખોરો સાથે હતો. આ હુલ્લડખોરો હુલ્લડ દરમિયાન ખૂન માટે ગુનેગાર હતો. «લોકો પિલાત પાસે આવ્યા. અને તેને હમેશા તે જંમ કરતો હતો તે પ્રમાણે એક કેદીને મુક્ત કરવા કહ્યું.

પિલાતે લોકોને કહ્યું, «તમે યહુદીઓના રાજાને મારી પાસે મુક્ત કરવાના ઈચ્છા છો?» ૧૦ પિલાતે જાણ્યું કે મુખ્ય યાજકોએ તેને ઈસુને સૌંઘ્યો હતો કારણ કે તેઓને ઈસુની ઈર્ધા હતી. ૧૧ પરંતુ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્રક્યા કે તેઓ પિલાતને બરબાસને મુક્ત કરવાનું કહે, ઈસુને નહિ.

૧૨ પિલાતે લોકોને ફરીથી પૂછ્યું, «તેથી મારે આ માણસ જેને તમે યહુદીઓના રાજા કહો છો તેની સાથે શું કરવું?»

૧૩ એ લોકોએ ફરીથી બૂમો પાડી, «તેને વધસ્તંભ પર ચઠાવો અને મારી નાખ્યો!»

૧૪ પિલાતે પૂછ્યું, «શા માટે? તેણે શું કર્યું છે?»

પરંતુ લોકોએ માટેથી બૂમો પાડી,

«વધસ્તંભ પર તેને મારી નાખ્યો!»

૧૫ પિલાતે લોકોને ખૂશ કરવા ઈચ્છતો હતો. તેથી પિલાતે તેમના માટે બરબાસને મુક્ત કર્યો અને પિલાતે સૈનિકોને ઈસુને ચાબખાથી મારવા કહ્યું, પછી પિલાતે ઈસુને વધસ્તંભ પર મારી નાખવા માટે સૈનિકોને હવાલે કર્યો.

૧૬ પિલાતના સૈનિકો ઈસુને હાડેમના મહેલમાં લાવ્યા (પ્રૈતાર્યુમ કહેવાતા), તેઓએ બીજા બધા સૈનિકોને સાથે બોલાવ્યા. ૧૭ તે સૈનિકોએ ઈસુને જાંબલી રંગનો ઝબ્બો પહેરાવ્યો. પછી તેઓએ કાટાનો મૂગટ ગુંઠીને તેના માથા પર મૂક્યો. ૧૮ પછી તેઓએ ઈસુને બોલાવ્યો. અને કહ્યું, «હે યહુદીઓના રાજા સલામ!» અમે કહીને તેઓ તેન પ્રાણામ કરવા લાગ્યા. ૧૯ સૈનિકોએ ઈસુને તેના માથા પર લાકડી વડે ઘણી વખત માયો. તેઓ પણ તેના પર થૂક્યા. પછી તેઓ ઈસુને ઘૂંઠો પડ્યા. અને નીચા પડીને નમસ્કાર કરીને તેના છઢા કર્યા. ૨૦ તેઓએ ઈસુનાં છઢા કરી રહ્યા પછી તે સૈનિકોએ જાંબલી રંગનો ઝબ્બો ઉતારીને તેનાં કપડાં ફરીથી પહેરાવ્યા. પછી તેઓ ઈસુને મહેલમાંથી બહાર કાઢીને વધસ્તંભ પર મારી નાખવા માટે લઈ ગયા.

ઈસુનું વધસ્તંભ પર મૃત્યુ

૨૧ ત્યાં કુરીનાં એક માણસ શહેરમાં ચાલતો આવતો હતો. તે માણસ સિમોન આલેક્સાંડર અને રૂફસનો બાપ હતો. સિમોન ખેતરોમાંથી શહેરમાં ચાલતો હતો. તે સૈનિકોએ ઈસુ માટેનો વધસ્તંભ બગાન્કારે સિમોન પાસે ઉચ્ચાવ્યો. રૂટેઓ ગુલગુથા નામની જગાએ ઈસુને દોરી ગયા. (ગુલગુથાનો અર્થ “ખોપરીની જગ્યા.”)

૨૨ ગુલગુથામાં સૈનિકોએ ઈસુને દ્રાક્ષારસ પીવા આપ્યો. આ દ્રાક્ષારસ બોળ સાથે બેળવલ હતો. પરંતુ ઈસુઅ તે પીવાની ના પાડી. ૨૩ સૈનિકોએ ઈસુને વધસ્તંભે ખીલે જાયો. પછી સૌનિકોએ ઈસુના કપડાં તેમની જાત અંદરો અંદર વહેંચી લીધા. પહેરેલા કયા કપડાંનો કયો ભાગ કયા સૈનિક લેવો તે નક્કી કરવા માટે તેઓ પાસા વડે જુગાર રમ્યા. ૨૪ પછી ઈસુને તેઓએ વધસ્તંભ પર જાયો તે વખતે સવારના નવ વાગ્યા હતા. ૨૫ ત્યાં એક લેખિત નોંધ હતી જેના પર તહોમતનામું લખેલું હતું: «યહુદીઓનો રાજા.» ૨૬ તેઓએ બે લૂટારાઓને ઈસુની બાજુમાં વધસ્તંભો પર જડ્યા હતા. તેઓએ એક લૂટારાને ઈસુની જમાણી બાજુ મૂક્યો હતો અને તેઓએ બીજા લૂટારાને ઈસુની ડાલી બાજુઅ મૂક્યો હતો. ૨૭ તે ગુનેગારોમાં ગણાયો અનું શાસ વચનમાં છે તે પૂર્ણ થયું. ૨૮ બાજુમાં ચાલતા લોકોએ ઈસુની નિદા કરી. તેઓએ તેમના માથાં હવાલ્યા અને કહ્યું, «તે કહ્યું, તું મંદિરનો વિનાશ કરી શકે છે અને તેને ફરીથી નશ દિવસમાં બાંધી શકે છે. ૨૯ તો તારી જાતને બચાવ! તું વધસ્તંભ પરથી નીચે ઉત્તી આવ!»

૩૦ અખુખ્ય યાજકો અને શાસીઓ પણ ત્યાં હતા. તેઓએ પણ બીજા લોકોની જેમ જ કર્યું. અને ઈસુની ઠક્કા મશકરી કરી અને કહ્યું, «તેણે બીજા લોકોને બચાવ્યા પણ તે તેની જાતને બચાવી શકતો નથી. ૩૧ જો તે ખરેખર જિસની ઈસુના વધસ્તંભ પરથી નીચે આવીને તેની જાતને બચાવવી જોઈએ. આપણે આ જોઈશું અને પછી અમે તેનામાં વિશ્વાસ મૂકીશું» તે લૂટારાઓ કે જેઓને ઈસુની બાજુમાં વધસ્તંભ પર મારી નાખવાના હતા, તેઓએ પણ તેની નિદા કરી.

ઈસુ મરણ પામે છે

૩૨ અપોરે આખા દેશમાં અંધકાર છવાઈ ગયો. આ અંધકાર ત્રણ વાગ્યા સુધી ચાલુ રહ્યો. ૩૩ ત્રણ વાગ્યા ઈસુએ મોટા સાદે પોકાર કર્યા, «અલોઈ, અલોઈ, લમા શબકથની.» આનો અર્થ છે, «મારા દેવ, મારા દેવ, તેં

મન શા માટે એકલો મૂકી દીધો?" ૩૫ન્યાં ઊભા રહેલા કેટલાક લોકોએ આ સાંભળ્યું તે લોકોએ કહ્યું, "ધ્યાનથી સાંભળો! તે એલિયાને બોલાવે છે."

૩૬એક માણસ ત્યા દ્વારા અને વાદળી લીધી. તે માણસે વાદળીને સરકારી ભરી અને વાદળીને લાકડીએ બાંધી. પછી ઈસુને તેમાંથી પાણી પીવા તે વાદળી આપવા તેણે લાકડીનો ઉપયોગ કર્યો. તે માણસે કહ્યું, "હવે આપણે રાહ જોઈએ અને જોઈએ કે એલિયા તેને વધસંભથી નીચે ઉત્તરાવ આવે છે કે કેમ."

૩૭પછી ઈસુએ મોટે સાંદર્થી ભૂમ પાડીને પ્રાણ છોડ્યો.

૩૮જ્યારે ઈસુ મરણ પામ્યો, તે જ વખતે મંદિરનો પડદો બે ભાગમાં ફાટી ગયો હતો. તે ઉપરથી શરૂ થયો અને છિક નીચે સુધી ફાટી ગયો. ૩૯લશ્કરનો અમલદાર જે ત્યા વધસંભ આગળ ઉભો હતો તેણે ઈસુનું મરણ થતાં શું બન્યું તે જોયું. તે અમલદારે કહ્યું, "આ માણસ ખરોખર દેવનો પુત્ર હતો!"

૪૦કલીક સીઓ વધસંભથી દૂર ઊભી રહ્યીને જોતી હતી. આ સીઓમાં મરિયમ માજદલાની, તેનો નાનો ભાઈ યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શલોમી હતી. (યાકૂબ તેનો સૌથી નાનો પુત્ર હતો.) ૪૧ાલીલમાં ઈસુની પાછળ આવનારી અને તેની સંભાળ રાખનારી આ સીઓ હતી. બીજી ઘણી સીઓ ત્યાં હતી. આ સીઓ યરૂશાલેમમાં ઈસુની સાથે આવી હતી.

ઈસુનું દફન

૪૨આ દિવસ સિદ્ધિકરણનો કહેવાય છે. (આનો અર્થ વિશ્વામવારના આગળનો દિવસ.) ત્યા અંધારું થઈ રહ્યું હતું. ૪૩યુસ્ક નામનો અરિમથાઈનો માણસ પિલાતે પાસે જઈને ઈસુનો મૃતદેહ લેવા જવા માટે પૂરતો બહાદૂર હતો. યુસ્ક યદ્વારીઓની સભાનો સન્માનીય સભ્ય હતો. દેવના રાજ્યનું આગમન ઈચ્છનારા લોકોમાના તે એક હતો. ૪૪પિલાતને સાંભળીને આશર્ય થયું કે ઈસુ હમેશા માટે મરણ પામ્યો હતો. પિલાતે લશકરી અમલદારને બોલાવ્યો. જે ઈસુની ચોકી કરતો હતો. પિલાતે અમલદારને પૂછ્યું; શું ઈસુ મરણ પામ્યો છે? ૪૫તે અમલદારે પિલાતને કહ્યું ક ઈસુ મરણ પામ્યો છે તેથી પિલાતે યુસ્કને કહ્યું, "તે શબ મણવી શક્યો" ૪૬યુસ્ક કેટલુક શશાનું કાપડ ખરીયું તેણે વધસંભા પરથી મૃતદેહ ઉતાર્યો. અને તે મૃતદેહને શશાના કાપડમાં વીટાયું. પછી યુસ્ક શબને કબરાંમાં મૂક્યું. જે ખડકની

દિવાલમાં ખોદી હતી. પછી યુસ્ક તે કબરના પ્રવેશદારને એક મોટો પથ્થર ગબડાલી બંધ કરી. ૪૭મરિયમ મજલા અન યોસેની માઝે ઈસુને જ જગ્યાએ મૂક્યો હતો તે જગ્યા જોઈ.

ઈસુના મૃત્યુમાંથી સજીવન થયાના સમાચાર

૧૬ દિવસ, મરિયમ મજલા, શલોમી, તથા યાકૂબની મા મરિયમે કેટલાક સુંગધીદાર દવ્યો તેને ચોળવા સારું વેચતાં લીધા. જે અઠવાડિયાના પ્રથમ દિવસ, વહેલો સવારમાં તે સીઓ કબર તરફ જતી હતી. સુર્યાદય પહેલા તે ધણા વહેલા હતા. જે સીઓએ એકબીજાને કહ્યું, "ત્યાં એક મોટો પથ્થર હતો જે કબરના પ્રવેશદારને ઢાકતો હતો. આપજા માટે તે પથ્થર કાણ ખસેડશે?"

૪૮પછી તે સીઓએ નજર કરી અને જોયું તો પથ્થર ખસેડેલો હતો. તે પથ્થર ઘણો મોટો હતો. પરંતુ તે પ્રવેશદાર પાસેથી દૂર ખસેડાઈ ગયો હતો. પ્રેરીઓ કબરમાં ગઈ. તેઓએ ત્યાં એક યુવાન માણસને સંફેદ જર્બો પહેલો જોયો. તે માણસ કબરની જમાણી બાજુએ બેઠેલો હતો. તે સીઓ ડરતી હતી. ૪૯પરંતુ તે માણસે કહ્યું, "ડરણો નહિ, તમે નાજરેથના ઈસુને શોધો છો. જેને વધસંભ પર મારી નાખવામાં આવ્યો હતો. તે મૂંબેલામાંથી ઉઠાયો છે! તે અહીં નથી; જુઓ, અહીં તે જગ્યા છે, તેઓએ તેને મૂક્યો હતો જ્યારે તે મરણ પામ્યો હતો. જીવે જાઓ, અને તના શિષ્યોને કહો અને પિતરને પણ કહો કે તે (ઈસુ) તમને ત્યાં મળશે. શિષ્યોને કહો, 'ઈસુ ગાલીલમાં જાય છે. તે તમારા પહેલા ત્યાં હશે. અગાઉ તેણે કલ્યાણ પ્રમાણે તમે તેને ત્યાં જોશો.'" જે સીઓ ઘણી ડરી ગઈ હતી અને મુઝાઈ ગઈ હતી. તેઓ કબર ધોડીને દૂર ધોડી ગઈ. તે સીઓએ જે કિં બન્યું હતું તે વિષે કોઈને પણ કશીજ કહ્યું નહિ કરાશું કે તેઓ ડરતી હતી.

કેટલાક જૂની ગ્રીક નકલોમાં માર્કિનું

પુસ્તક અહીં પૂર થાય છે.

કેટલાક શિષ્યો ઈસુને જુબે છે

ઈસુ અઠવાડિયાના પ્રથમ દિવસ મૂંબેલામાંથી ઊભ્યો. ઈસુએ પોતાની જાતે પ્રથમ મરિયમ મજલાને દર્શન આપ્યા. એક વખત ભૂતકાળમાં ઈસુએ મરિયમમાંથી સાત અશુદ્ધ આત્માઓને બહાર ક્રાણ્યા હતા. ૧૦મરિયમ ઈસુને જાયા પછી તેના શિષ્યોને જઈને

તેણે કંધું, તેના શિષ્યો ઘણા છુંખી હતા. અને રુદ્ધન કરતા હતા. ૧૪ખ મરિયમે તેઓને કંધું કે ઈસુ જીવતો છે. મરિયમે કંધું કે તેણે ઈસુને જોયો છે. પણ શિષ્યો તેનું માનતા નહોતા. ૧૫એ ઈસુને પોતાના દર્શન આપ્યા. જ્યારે શિષ્યો પોતાના બેતરમાં ચાલતા જતા હતા ત્યારે થોડા સમય પછી ઈસુને પોતાની જાતે તે લોકોને દર્શન આપ્યા. પરંતુ ઈસુ મરણ પામતા પહેલા જેવો દેખાતો નહોતો. ૧૬આ શિષ્યો બીજા શિષ્યો પાસે પાણ ગયા અને જે બન્ધું હતું તે તેમને કંધું. ફરીથી શિષ્યોએ અન્માનું કોઈનું પણ માન્યું નહિ.

ઈસુ પ્રેરિતો સાથે વાત કરે છ

૧૭પાછળથી ઈસુને પોતાની જાતે અગિયાર શિષ્યો જ્યારે તેઓ ખાતા હતા, ત્યારે દર્શન દીધા. ઈસુને શિષ્યોને દફકો આપ્યો, કારણ કે તેઓને ઓછા વિશ્વાસ હતો. તેઓ કઠળ હદયના હતા. અને જે લોકોએ ઈસુને મૂઅલામાંથી સજીવન થયેલો જોયો તેઓનું માનવા તેઓ તૈયાર નહોતા. ૧૮ઈસુને શિષ્યોને કંધું, "દુનિયામાં

દરેક જગ્યાએ જાઓ, પ્રચ્યેક વ્યક્તિને સુવાર્તા કહો. ૧૯જે કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે અને બાનિસ્મા લે તે તારણ પામશે. પરંતુ જે વ્યક્તિ વિશ્વાસ ધરાવતી નથી તે ગુનેગાર ગણાશે. ૨૦અને જે લોકો વિશ્વાસ કરે છે તેઓ સાબિતી તરીકે આવા પ્રકારના ચમત્કારો કરવા સમર્થ થશે. તેઓ લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢવા મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કદી શીખ્યા નથી તેવી ભાષાઓમાં તેઓ બોલશે. ૨૧ઈજા પામ્યા વગર તેઓ સર્પાને તેમના હાથમાં પકડશે. ઈજા વગર વિષપાન કરશે. તેઓ બિમાર લોકો પર હાથ મૂકશે અને બિમાર લોકો સાજ થશે."

૨૨પ્રભુ ઈસુને શિષ્યોને આ વાતો કંધ્યા પછી, તેને આકાશમાં લઈ લેવાયો. ત્યાં ઈસુ દેવની જમણી બાજુએ બેઠો. ૨૩તેના શિષ્યો જગતમાં દરેક જગ્યાએ ગયા અને લોકોને સુવાર્તા પ્રગટ કરી. અને પ્રભુએ તેઓને મદદ કરી. પ્રભુએ સિદ્ધ કર્યું કે તેણે લોકોન આપેલ સુવાર્તા સાચી હતી. તેણે શિષ્યોને ચમત્કારો કરવાનું સામર્થ્ય આપીને આ સાબિત કર્યું.

License Agreement for Bible Texts

World Bible Translation Center
Last Updated: September 21, 2006

Copyright © 2006 by World Bible Translation Center
All rights reserved.

These Scriptures:

- Are copyrighted by World Bible Translation Center.
- Are not public domain.
- May not be altered or modified in any form.
- May not be sold or offered for sale in any form.
- May not be used for commercial purposes (including, but not limited to, use in advertising or Web banners used for the purpose of selling online add space).
- May be distributed without modification in electronic form for non-commercial use. However, they may not be hosted on any kind of server (including a Web or ftp server) without written permission. A copy of this license (without modification) must also be included.
- May be quoted for any purpose, up to 1,000 verses, without written permission. However, the extent of quotation must not comprise a complete book nor should it amount to more than 50% of the work in which it is quoted. A copyright notice must appear on the title or copyright page using this pattern: "Taken from the HOLY BIBLE: EASY-TO-READ VERSION™ © 2006 by World Bible Translation Center, Inc. and used by permission." If the text quoted is from one of WBTC's non-English versions, the printed title of the actual text quoted will be substituted for "HOLY BIBLE: EASY-TO-READ VERSION™." The copyright notice must appear in English or be translated into another language. When quotations from WBTC's text are used in non-saleable media, such as church bulletins, orders of service, posters, transparencies or similar media, a complete copyright notice is not required, but the initials of the version (such as "ERV" for the Easy-to-Read Version™ in English) must appear at the end of each quotation.

Any use of these Scriptures other than those listed above is prohibited. For additional rights and permission for usage, such as the use of WBTC's text on a Web site, or for clarification of any of the above, please contact World Bible Translation Center in writing or by email at distribution@wbtc.com.

World Bible Translation Center
P.O. Box 820648
Fort Worth, Texas 76182, USA
Telephone: 1-817-595-1664
Toll-Free in US: 1-888-54-BIBLE
E-mail: info@wbtc.com

WBTC's web site – World Bible Translation Center's web site: <http://www.wbtc.org>

Order online – To order a copy of our texts online, go to: <http://www.wbtc.org>

Current license agreement – This license is subject to change without notice. The current license can be found at: <http://www.wbtc.org/downloads/biblelicense.htm>

Trouble viewing this file – If the text in this document does not display correctly, use Adobe Acrobat Reader 5.0 or higher. Download Adobe Acrobat Reader from:
<http://www.adobe.com/products/acrobat/readstep2.html>

Viewing Chinese or Korean PDFs – To view the Chinese or Korean PDFs, it may be necessary to download the Chinese Simplified or Korean font pack from Adobe. Download the font packs from:
<http://www.adobe.com/products/acrobat/acrasianfontpack.html>